


નિમિત્તોપાદાન



ડૉ. હૃકમયન્દ માર્ણવ



નિમિતોપાદાન

નિમિતોપાદાન
(સ્વરૂપ મેળાન) નિમિતોપાદાન
નિમિતોપાદાન
(સ્વરૂપ મેળાન) નિમિતોપાદાન

◎ : લેખક :
ડૉ. હુકમચંદ ભારિલ

શાસ્ત્રી, ન્યાયતીર્થ, સાહિત્યરણ, એમ.એ., પીએચ.ડી.
શ્રી ટોડરમલ સ્મારક ભવન, એ-૪, બાપૂનગર, જયપુર - ૩૦૨૦૧૪.

: અનુવાદક :
સંગીતાબેન નવનીતલાલ શાહ
બી. એસ. સી.

: પ્રકાશક :
પંક્તિ ટોડરમલ સ્મારક ટ્રસ્ટ
એ-૪, બાપૂનગર, જયપુર - ૩૦૨૦૧૪.

પ્રથમ આવૃત્તિ	: ૧૨ હજાર
(૨૪ માર્ચ, ૧૯૯૧)	
દ્વિતીય આવૃત્તિ	: ૩ હજાર
(૧ ઓગસ્ટ, ૧૯૯૭)	
ગુજરાતી (પ્રથમ આવૃત્તિ)	: ૩ હજાર

કુલ

: ૧૮ હજાર

મૂલ્ય : ત્રણ રૂપિયા પચાસ પૈસા

વિષય સૂચી

૧. નિમિતોપાદાન : એક અનુશીલન	૧
૨. નિમિતોપાદાન : કેટલાક પ્રશ્નોત્તર	૨૪
૩. પરિશિષ્ટ - ૧ :	૪૮
ઉપાદાન - નિમિત દોહા :	
કવિવર પં. બનારસીદાસ	
૪. પરિશિષ્ટ - ૨ :	૪૮
ઉપાદાન - નિમિત દોહા :	
લેખા ભગવતીદાસ	

મુદ્રક :

જ્યાપુર પિન્ટર્સ

અમ.આઈ.રોડ,

જ્યાપુર.

.....પ્રકાશકીય.....

જે નદર્શનના મર્મજી વિવાન ડૉ. હુકમચંદજી ભારિલ્લ કૃત નિમિતોપાદાનનું પ્રકાશન કરતાં અમને હાર્દિક પ્રસન્નતાનો અનુભવ થઈ રહ્યો છે. જેનદર્શનના આધ્યાત્મિક ક્ષેત્રમાં પૂજાય શ્રી કાનજી સ્વામીના ઉદ્ઘની સાથે-સાથે જે વિપય બહુચર્ચિત થયાં તેમાં મુખ્ય છે - ક્રમબદ્ધ પર્યાપ્તિ, નિશ્ચય-વ્યવહાર અને ઉપાદાન-નિમિત્ત. એના સંદર્ભમાં ગામે-ગામ ચાલતી ચચાંને એક વિવાદનું રૂપ લઈ લીધું હતું. જેમ-જેમ આ આધ્યાત્મિક કાન્તિ વિસ્તાર પામતી ગઈ, તેમ-તેમ વિવાદે પાણ ઉચ્ચરૂપ ધારાણ કર્યું.

વિવાદના ઊંડાગમાં જઈને જેતાં એક તથ્ય સામે આવ્યું કે વિપયનો અપરિયે જ વિવાદનું મૂળ કારાગ છે. તેથી એ નિશ્ચય કરવામાં આવ્યો કે જે આ વિપયોને આગમના આધારે સરળ-સુભોધ શૈલીમાં જન-જન સમજી પ્રસ્તુત કરવામાં આવે તો વિવાદ સહજ જ શાંત થઈ શકે છે.

જ્યારે ડૉ. ભારિલ્લે આ વિપયો પર ગામે-ગામ સરળ-સુભોધ શૈલીમાં સપ્રમાણ પ્રવચન કર્યા તો તેનો અનુકૂળ પ્રભાવ પડ્યો. ત્યારે એમ નિર્ણય કરવામાં આવ્યો કે જે આ વિપયોને લેખિત રૂપમાં પાણ પ્રસ્તુત કરવામાં આવે તો સહીળતા અવસ્થાની છે. પરિણામ સ્વરૂપ ક્રમબદ્ધપર્યાપ્તિ અને પરમભાવ પ્રકાશક નયચક જેવી કૃતિઓ સામે આવી; જેમાણે તત્સંબંધી વિવાદોને લગભગ સમાપ્ત જ કરી દીધા.

એ જ ક્રમમાં આ 'નિમિતોપાદાન' કૃતિ છે. અમને વિશ્વાસ છે કે આનાથી આધ્યાત્મિક સમાજ લાભાન્વિત થશે.

પ્રસ્તુત કૃતિના લેખન કાર્ય હેતુ ડૉ. હુકમચંદજી ભારિલ્લ અભિનંદનને પાત્ર છે. પુસ્તકની કિમત ઘટાડવા માટે જે મહાનુભાવોએ આર્થિક સહયોગ પ્રદાન કર્યો છે તેમનો ટ્રસ્ટી વદ્યથી આભારી છે. સાથે-સાથે પ્રકાશન વ્યવસ્થા હેતુ વિભાગના પ્રભારી શ્રી અભિલ બંસલ પાણ ભાવના સાથે

નેમીયન્દ પાઠની

મહામંત્રી

.....અનુવાદકની કલમે.....

શ્રી જિનેન્દ્ર પરમાત્માની દિવ્યધ્વનિમાં પ્રતિપાદિત ચાર અનુયોગનો સાર વીતરાગતા છે. અને ચારે અનુયોગમાંથી વીતરાગતાનું દોહન કરવા માટે શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થનું જ્ઞાન હોવું જરૂરી છે. આ જીવની અનાદિ કાળથી નિમિત્તાધીન દર્શિ છે. શાખમાં પાણ નિમિત્ત પ્રધાન કથન ધાર્ણા જેવા મળે છે. હવે તેનો યથાર્થ બોધ નહીં હોવાના કારણે આ જીવ નિમિત્ત-નેમિતક સંબંધને કર્તા-કર્મ સંબંધ માની લે છે તેથી તેની દર્શિ નિમિત્ત ઉપરથી હઠી ઉપાદાન ઉપર આવવી મુશ્કેલ થઈ પડે છે. ફરિ સ્વરૂપે તેને સુખ, શાંતિ અને ધર્મની પ્રાપ્તિ થતી નથી અને સંસાર પરિભ્રમાગું ચાલું જ રહે છે.

આ કાળમાં આધ્યાત્મિક સત્યપુરુષ પૂજન્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ નિમિત્ત-ઉપાદાનનું સ્વરૂપ ધારું જ સ્પષ્ટ કર્યું છે. તેઓ શ્રીએ લૈયા ભગવતીદાસ તેમજ કવિવર પંડિત બનારસીદાસ દારા રચિત ‘ઉપાદાન-નિમિત્ત દોહા’ ઉપર પ્રવચન પાણ કરેલ છે ને “મૂળમાં ભૂલ” નામના પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયેલ છે, ને આત્માર્થી જીવે અવશ્ય સ્વાધ્યાય કરવા યોગ્ય છે.

આધ્યાત્મિક પ્રવક્તા આદરણીય ડૉ. હુકમચંદ બારિલ્લે “નિમિત્તોપાદાન” નામની તેમની આ કૃતિમાં નિમિત્ત-ઉપાદાનનું સ્વરૂપ આગમના આધારે સ્પષ્ટ કર્યું છે. નેનાથી આધ્યાત્મિક સમાજ લાભાન્વિત થઈ રહ્યો છે.

ગુજરાતી ભાઈ-બહેનો પાણ પોતાની માતૃભાષા દારા આ પુસ્તકનું પઠન-મનન કરી લાભાન્વિત થાય તે હેતુથી તેનો ગુજરાતી અનુવાદ કરવાનું કાર્ય મને સોંપાયું હતું, જેમાં મને મુરજીબી વડીલ શ્રી પોપટલાલ ચુનીલાલ શાહ તથા ભાઈશ્રી શૈલેષભાઈ શાહના સલાહ-સૂચન તથા માર્ગદર્શન મળેલ છે તેઓની હું અલ્યંત આભારી હું. આ પુસ્તકનું મુદ્રિતીંગ કરનાર શ્રી રજનીભાઈ એમ. દોશી નો પાણ આભાર વ્યક્ત કરું હું. આ પુસ્તકના અનુવાદ કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ને ભાઈઓનો સહકાર પ્રાપ્ત થયેલ છે તે સર્વની હું આભારી હું.

દરેક જીવ નિમિત્ત-ઉપાદાનનું સાચું સ્વરૂપ સમજુને નિમિત્તાધીન દર્શિ છોડી સ્વભાવ સન્મુખ દર્શિ કરી સંસાર-પરિભ્રમાગુનો નાશ કરે અને પૂર્ણ સુખ-શાંતિને પ્રગટ કરે તેવી મંગળ ભાવના....

મહાત્મા નિર્ણયની પાત્ર 'અપાદાન-નિમિત્ત'.

મહાત્મા નિર્ણય માટે આ વિષયનું સમ્યક પરિજ્ઞાન અત્યંત કરી શકતું હતું છે.

પ્રથમ ખંડ

નિમિત્તોપાદાન : એક અનુશીલન

મુક્તિના માર્ગમાં જે મહત્વપૂર્ણ વિષયનું સમ્યક પરિજ્ઞાન અત્યંત આવશ્યક છે, એમાં 'ઉપાદાન-નિમિત્ત' પાણ એક એવો મહત્વપૂર્ણ વિષય છે, જેના સમ્યક જ્ઞાન વિના પરાવલબનની દાખિ તેમજ વૃત્તિ સમાપ્ત થતી નથી, સ્વાવલબનનો ભાવ અગૃત થતો નથી, મુક્તિના માર્ગનો સમ્યક પુરુપાર્થ પાણ સ્કુરાયમાન થતો નથી.

'ક્રમબદ્ધપર્યાય' અને નિશ્ચય-વ્યવહારની જેમ 'ઉપાદાન-નિમિત્ત' પાણ આજનો ચચ્ચિયદ વિષય છે; જેની ચર્ચા ક્રયારેય વિવાનનોની ગોઢીઓમાં પાણ થતી નહોતી, પરંતુ આજે તે જન-જનમાં ચર્ચિત છે. આ ચર્ચાએ જ્યાં એક બાજુ લોકોમાં જેના સંદર્ભમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરી છે, તત્સંબંધી સાહિત્યના અધ્યયન માટે પ્રેરિત કર્યા છે; ત્યાં બીજી બાજુ કેટલાક વિવાદ પાણ ઊભા થયા છે. આજે આ ચર્ચાએ પક્ષ-વિપક્ષનું રૂપ લઈ લીધું છે. આ જ કારાણ છે કે આ સંદર્ભમાં આજે જ્યારે પાણ કોઈ કાંઈ બોલે કે લખે છે તો તેની વાગ્યી કે લેખનીમાં પક્ષ-વિપક્ષની ગંધ આવે છે; સમાજ પાણ તેને પક્ષ કે વિપક્ષના રૂપમાં જ ગ્રહણ કરે છે.

આજનો આ વિવાદ સંઘર્ષમાં પરિવર્તિત ન થઈ જાય એના માટે એ અત્યંત આવશ્યક છે કે આગમના આધારે આ વિષય પર ગંભીરતાથી નિષ્પક્ષ મંથન કરવામાં આવે અને તેને સમાજ સમક્ષ સરળ-સુભોધ ભાષામાં પ્રસ્તુત કરવામાં આવે. આ વિષયનું સર્વાંગ અનુશીલન જ વિવાદ અને સંઘર્ષથી બચવાનો એકમાત્ર ઉપાય છે. વસ્તુસ્વરૂપના પરિજ્ઞાન માટે પાણ ઉપાદાન-નિમિત્તની તર્કસંગત, આગમસંમત સુવ્યવસ્થિત જાગ્રકારી અત્યંત આવશ્યક છે.

‘નિશ્ચય-વ્યવહાર’ અને ‘કુમબદ્વયર્થ્ય’ જેવા વિવાદાસ્પદ વિષય પાણ જ્યારે આગમના આધારથી સરળ-સુભોધ ભાષામાં પ્રસ્તુત કરવામાં આવ્યા; ત્યારે વિદ્વદર્શ અને સમાજે તેની પ્રશંસા કરી, એટલું જ નહિ બલ્કે તત્ત્વબંધી વિવાદ પાણ લગભગ સમાપ્ત થઈ ગયો. તેથી મને પૂર્ણ વિશ્વાસ છે કે જો ઉપાદાન-નિમિત્તનું પાણ એ પ્રમાણે અનુશીલન કરવામાં આવે તો અપેક્ષિત લાભ જરૂર થશે.

ઉપાદાન-નિમિત્તના સમ્યક્ પરિજ્ઞાનના અભાવમાં નિનાગમમાં પ્રતિપાદિત વસ્તુવ્યવસ્થાને પાણ સમ્યક્રૂપે સમજવી સંભવ નથી. ઉપાદાન-નિમિત્ત સંબંધી સમ્યજ્ઞાનના અભાવમાં કાં તો નિમિત્તને કર્તા માની બેથામાં આવે છે કાં તો પછી તેની સત્તાનો જ ઈન્કાર કરવામાં આવે છે; તેથી એ જરૂરી છે કે આપણે ઉપાદાન-નિમિત્તને વિવાદના રૂપમાં ન જોતા, તેના પક્ષ અને વિપક્ષમાં પાણ કાંઈ ન કહેતાં, તેના સ્વરૂપ પર જ આગમના આધારે વિચાર કરીએ. તેનું સ્વરૂપ સમ્યક્પાણ સ્પષ્ટ થતાં સંપૂર્ણ સ્થિતિ સહજ જ સ્પષ્ટ થઈ જશે.

જગતનો પ્રત્યેક પદાર્થ પરિણમનશીલ છે. પદાર્થોના આ પરિણમનને પથાર્થ અથવા કાર્ય કહે છે. આ પરિણમનને જ કર્મ, અવસ્થા, હાલત, દશા, પરિણામ, પરિણતિ વગેરે નામોથી પાણ ઓળખવામાં આવે છે.

કાર્ય કારણપૂર્વક જ થાય છે અને કાર્યની ઉત્પાદક સામગ્રીને જ કારણ કહેવામાં આવે છે. તે કાર્યની ઉત્પાદક સામગ્રી ઉપાદાન અને નિમિતોના રૂપમાં હોય છે. આ જ કારણે નિનાગમમાં ઉપાદાન અને નિમિતોની ચર્ચા કારણોના રૂપમાં થઈ છે અને એટલા માટે જ કારણ પાણ બે પ્રકારના મનાય છે-

(૧) ઉપાદાન કારણ અને (૨) નિમિત્તકારણ.

જે સ્વયં કાર્યરૂપે પરિણમે તેને ઉપાદાનકારણ કહે છે અને જે સ્વયં તો કાર્યરૂપે ન પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જેના પર આવી શકે, તેને નિમિત્તકારણ કહે છે. જેમ કે- ‘ઘટ’ રૂપ કાર્યનું

એક અનુશીલન

‘માર્ટી’ ઉપાદાન કારાગ છે અને ચક, દંડ અને કુંભાર આદિ નિમિત્ત કારાગ છે. ૩

જે પદાર્થમાં કાર્ય નિષ્પત્તન થાય છે, તે પદાર્થને ઉપાદાન કારાગ અને જે કાર્ય નિષ્પત્તન થયું છે, તેને ઉપાદેય કહેવામાં આવે છે તથા નિમિત્તકારાગની અપેક્ષાએ કથન કરતાં તે જ કાર્ય (ઉપાદેય)ને નેમિત્તક પાગ કહેવામાં આવે છે. આ પ્રમાણે આપાગે જોઈએ છીએ કે એક જ કાર્યને ઉપાદાન કારાગની અપેક્ષાએ ઉપાદેય અને નિમિત્તકારાગની અપેક્ષાએ નેમિત્તક કહેવામાં આવે છે. જે ‘ઘટ’ રૂપ કાર્ય ‘માર્ટી’ રૂપ ઉપાદાન કારાગનું ઉપાદેય કાર્ય છે, તે જ ઘટ’ રૂપ કાર્ય ‘કુંભાર’ રૂપ નિમિત્તકારાગનું નેમિત્તક કાર્ય છે. તાત્પર્ય એ છે કે ‘માર્ટી’ અને ‘ઘટ’ માં ઉપાદાન-ઉપાદેય સંબંધ છે તથા ‘કુંભાર’ અને ‘ઘટ’ માં નિમિત્ત-નેમિત્તક સંબંધ છે.

જે આપાગે તેને સમૃદ્ધશનરૂપ કાર્ય પર ઘટિત કરીએ તો આ પ્રકારે કહેવાશે-આત્મદ્રવ્ય અથવા તેનો શ્રદ્ધાગુણ ઉપાદાન છે અને સમૃદ્ધશન ઉપાદેય છે; એ જ પ્રમાણે મિથ્યાત્વ કર્મનો અભાવ અથવા સદ્ગુરુનો ઉપદેશ નિમિત્ત છે અને સમૃદ્ધશન નેમિત્તિક છે.

અહીં ઉપાદેય શબ્દનો અર્થ ‘ગ્રહાગ કરવા યોગ્ય’ એમ નથી કરવાનો; કારાગ કે આ પ્રકરાગ હેય-ઉપાદેયને દર્શાવિનાં પ્રકરાગ નથી. અહીં તો કાર્ય-કારાગ સંબંધી પ્રકરાગ હોવાથી માત્ર એ સ્પષ્ટ કરવામાં આવે છે કે જે કાર્યને નિમિત્તની અપેક્ષાએ નેમિત્તિક કહેવામાં આવે છે, તે જ કાર્યને ઉપાદાનની અપેક્ષાએ ઉપાદેય કહેવામાં આવે છે.

આમ, એ સુનિશ્ચિત થયું કે ઉપાદાન-ઉપાદેય સંબંધ અને નિમિત્ત નેમિત્તિક સંબંધ કારાગ-કાર્ય સંબંધના જ રૂપ છે, જે પ્રત્યેક કારાગ-કાર્ય સંબંધ પર અનિવાર્યપાગે ઘટિત થાય છે. આ રીતે પ્રત્યેક કાર્ય નિયમથી ઉપાદેય પાગ છે અને નેમિત્તિક પાગ છે, ઉપાદાનની અપેક્ષાએ ઉપાદેય છે અને નિમિત્તની અપેક્ષાએ નેમિત્તિક છે.

અહીં એક પ્રશ્ન સંભવ છે કે જે ‘દ્રવ્ય કે ગુગુ’ ઉપાદાનકારાગ છે, જેવું કે સમૃદ્ધશનરૂપ કાર્યના ઉદાહરાગમાં બતાવવામાં આવ્યું છે, તો

निमित्तोपादान

४

विवक्षित कार्य निरंतर उत्पन्न थं न रहेवुं ज्ञेईं; केम के ज्यारे कारण
उपस्थित छे तो कार्य पाण थवुं न ज्ञेईं.

जे आना उत्तरमां अभ कहेवामां आवेके उपादान कारण तो द्रव्य
के गुण होवाथी सदाकाळ उपस्थित न रहे छे, परंतु निमित्तकारण न होवाथी
कार्य न थयुं; ज्यारे निमित्त कारण मध्ये, त्यारे कार्य संपन्न थई नशे.-
आवुं मानवाथी निमित्तकारण न नियामक कारण ठरशे; कारण के तेना होवा
के न होवाथी न कार्यनुं थवुं के न थवुं निर्भर करशे.

आ आपत्तिथी बचवा माटे जे अभ कहेवामां आवेके कार्यनी उत्पत्ति
मां तो बन्ने कारणोनी उपस्थिति अनिवार्य होय छे तो आपाणे कहीशुं के
भवेने बन्ने कारणोनी उपस्थिति अनिवार्य होय, पाण नियामक कारण तो
निमित्त न रह्युं; केम के तेना होवाथी कार्य थाय छे अने न होवाथी कार्य नथी
थं.

अरे भाई ! कार्यनुं नियामक कारण कयुं छे ? ए आशतां पहेलां
आपाणे उपादान-निमित्तने तेना भेद-प्रभेदो सहित सारी रीते समज्ज तो
लईं, पछी आ विवादमां पडीअ. संभव छे के उपादान-निमित्तना भेद-
प्रभेदोना स्पष्टीकरणथी आ प्रश्ननुं सहज न समाधान थई जाय.
वास्तवमां वात तो अभ छे के उपादान-निमित्तना भेद-प्रभेदोना
सम्बन्धानमां न प्रश्ननो उत्तर समायेलो छे. तेथी सौथी पहेलां तेना भेद-
प्रभेदोनी चर्चा न अपेक्षित छे.

उपादान बे प्रकारना होय छे-

(१) त्रिकाणी उपादान अने (२) क्षणिक उपादान

निमित्त पाण बे प्रकारना होय छे-

(१) उदासीन अने (२) ग्रेक

अथवा

(१) अंतरंग अने (२) बहिरंग.

ने द्रव्य के गुण स्वयं कार्यदृपे परिशमे, ते द्रव्य के गुणने ते कार्यनुं
त्रिकाणी उपादानकारण कहे छे.

ઓક અનુશીલન

૫

ક્ષાળિગુક ઉપાદાનકારણ બે પ્રકારના હોય છે-

(ક) દ્વય અને ગુગોમાં જે પર્યાયોનો પ્રવાહકમ અનાદિ-અનંત ચાલ્યા કરે છે, તે પ્રવાહકમમાં અનંતર-પૂર્વક્ષાળુવતીપર્યાય ક્ષાળિગુક ઉપાદાન કારણ છે અને અનંતર-ઉત્તર ક્ષાળવતીપર્યાય કાર્ય છે. આને આ પ્રમાણે પાળ કહેવામાં આવે છે કે અનંતર પૂર્વ ક્ષાળવતી પર્યાયથી યુક્ત દ્વય કારણ છે અને અનંતર ઉત્તરક્ષાળવતી પર્યાયથી યુક્ત દ્વય કાર્ય છે.

ઉક્ત સંદર્ભમાં કાતિક્યાનુપ્રેક્ષાનું નીચેનું કથન દ્વારા દ્વય છે-

“પુષ્વપરિણામજુત્ત કારણભાવેણ વહૃદે દવ્વં ।

ઉત્તર પરિણામ જુદં તં ચિય કજ્જં હવે ણિયમા ॥ ૨૩૦ ॥

અનંતર પૂર્વ પરિણામથી યુક્ત દ્વય કારણદ્વારે પરિણમિત થાય છે અને અનંતર-ઉત્તરપરિણામથી યુક્ત તે જ દ્વય નિયમથી કાર્ય હોય છે.”

આ જ વાતને સ્પષ્ટ કરતાં સિદ્ધાન્તાચાર્ય પંડિત કૂલચંદજી લખે છે

- “ને અનંતર પૂર્વ પર્યાય વિશિષ્ટ દ્વય છે, તેની ઉપાદાન સંજ્ઞા છે અને ને અનંતર-ઉત્તરપર્યાય વિશિષ્ટ દ્વય છે, તેની કાર્ય સંજ્ઞા છે.”

(ખ) તે સમયની પર્યાયની તે રૂપે થવાની યોગ્યતા ક્ષાળિગુક ઉપાદાન-કારણ છે અને તે પર્યાય કાર્ય છે.

આ રીતે ઉપાદાનકારણ ત્રાળ પ્રકારના થઈ ગયા, જે આ પ્રમાણે

શ્રી-

(૧) ત્રિકાળી ઉપાદાન

(૨) અનંતર પૂર્વક્ષાળુવતીપર્યાયના વ્યારૂપ ક્ષાળિગુક ઉપાદાનકારણ.

(૩) તત્સમયની યોગ્યતારૂપ ક્ષાળિગુક ઉપાદાનકારણ.

ક્ષાળિગુક ઉપાદાનના નામ લાંબા હોવાના કારણો તેમને નીચેના સંક્ષિપ્ત નામોથી પાળ ઓળખવામાં આવે છે-


(ક) અનંતર પૂર્વક્ષાળુવતીપર્યાય.

(ખ) તત્સમયની યોગ્યતા.

ઉપાદાનના ઉક્ત ત્રાળ બેદોની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે નીચેનો ચાર્ટ ઉપયોગી છે-

निमित्तोपादान

५



क्षणिक उपादानकारणे समर्थ उपादानकारण पाणु कહे छे, कारण
के त्रिकाणी उपादानकारण तो सदा विघमान रहे छे; जे तेने वज्र समर्थ
कारण मानी लेवामां आवे तो विवक्षित कार्यनी सदा उत्पत्ति थती रहेवानो
प्रसंग आवशे. अनंतर पूर्वक्षागवर्ती पर्यायिनो वय अने ते समये ते पर्याय
नी उत्पन्न थवानी योग्यता वज्र समर्थ उपादानकारण छे; जेना विना कार्यनी
उत्पत्ति थती नथी अने जेना लोवाथी नियमथी कार्यनी उत्पत्ति थाय छे.

तत्वार्थश्लोकवार्तिकमां उपादानना बे भेद पाठवामां आव्या छे-
एक अन्यमर्थ उपादान अने बीजुं समर्थ उपादान. एमां ले समर्थ उपादान
छे, ते अवश्य वज्र कार्यनु जनक होय छे अने ते अष्टसहस्रीना
अभिप्रायानुसार अव्यवहित पूर्वपर्याययुक्त द्रव्यङ्ग वज्र होय छे.^१

आ रीते आटला विवेचनथी ए सपष्ट थर्ड जाय छे के समर्थ उपादान
एक वज्र होय छे अने तेनाथी उत्पन्न थवावाणुं कार्य ते वज्र होय छे, के जेनुं
ते समर्थ उपादान होय छे. त्यां ते कार्यनु ले पाणु निमित्त होय छे, तेमां
उपादाननी किया करवानी शक्ति वज्र होती नथी. मात्र ते उपादान अनुसार
थवावाणा कार्यनु सूचक लोवाथी तेनु निमित्त कहेवाय छे. अने आ वज्र आधारे
निमित्तना अनुसारे कार्य थाय छे, ऐवो व्यवहार (उपचार) करवामां आवे
छे:^२

१. जेन तत्व समीक्षानुं समाधान (हिन्दी) पृष्ठ-१५

२. जेन तत्व समीक्षानुं समाधान (हिन्दी) पृष्ठ-१५

એક અનુશીલન

ઉક્ત વિવેચનથી એ સ્પષ્ટ થાય છે કે નિયામક કારણ ત્રિકાળી ઉપાદાન કારણ નહીં, પરંતુ ક્ષાળિક ઉપાદાનકારણ છે. નિમિત્તકારણને નિયામક કારણ માનનારાઓને આ તથય તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ.

નિમિત્તને નિયામક કારણનું પ્રસ્તુત કરતી વખતે એ તર્ક આપવામાં આવ્યો હતો કે ઉપાદાન તો સદા વિદ્યમાન રહે છે, જે તેને જ નિયામક કે સમર્થ કારણ માની લેવામાં આવે તો કાર્યનો સદા ઉત્પન્ન થતા રહેવાનો પ્રસંગ આવશે.

ઉક્ત સંદર્ભમાં વસ્તુસ્થિતિ એ છે કે ત્રિકાળી ઉપાદાનકારણને જ ઉપાદાન કારણ માનીને એમ કહેવામાં આવ્યું હતું કે ઉપાદાન તો સદાને માટે મૌજૂદ છે. જ્યારે ક્ષાળિક ઉપાદાન પાણ ઉપાદાન જ છે, જે સદા ઉપસ્થિત નથી રહેતું; તેથી ઉપાદાનને સમર્થ કારણ માનતાં કાર્ય સદા થતું રહેવાનો પ્રસંગ ઉપસ્થિત થવાનો આરોપ નિરાધાર છે; કેમ કે કાર્યનું નિયામક કારણ તો ક્ષાળિક ઉપાદાન છે, ત્રિકાળી ઉપાદાન નહીં.

અહીં એક પ્રશ્ન સંભવ છે કે જે ક્ષાળિક ઉપાદાન જ સમર્થ ઉપાદાન છે તો પછી ત્રિકાળી ઉપાદાનનું શું મહત્વ રહ્યું ?

ભાઈ, વાત એમ છે કે ઉપાદાન તો નિજશક્તિને કહે છે. જેમ કે કહ્યું છે કે-

ઉપાદાન નિજ શક્તિ હૈ, જિયકો મૂલ સ્વભાવ;
હે નિમિત્ત પરયોગ તે, બન્યો અનાદિ બનાવ.¹

શક્તિ બે પ્રકારની હોય છે- દ્રવ્યશક્તિ અને પર્યાયશક્તિ. આ બન્ને શક્તિઓનું નામ જ ઉપાદાન છે. પર્યાયશક્તિથી યુક્ત દ્રવ્યશક્તિ જ કાર્યકારી હોય છે. દ્રવ્યશક્તિ નિત્ય હોય છે અને પર્યાય શક્તિ અનિત્ય. નિત્યશક્તિના આધારે કાર્યની ઉત્પત્તિ માનવાથી કાર્યના નિત્યત્વનો પ્રસંગ આવે છે; તેથી પર્યાયશક્તિનો જ કાર્યના નિયામક તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે.

1. લેખા ભગવતી દાસ : ઉપાદાન-નિમિત્ત સંવાદ-દોષા-૩

નિમિત્તોપાદાન

દ્રવ્યશક્તિ એમ બતાવે છે કે આ કાર્ય આ દ્રવ્યમાં જ થશે, અન્ય દ્રવ્યમાં નહીં અને પર્યાયશક્તિ એમ બતાવે છે કે વિવક્ષિત કાર્ય વિવક્ષિત સમયમાં જ થશે. તેથી ન તો દ્રવ્યશક્તિ મહત્વહીન છે કે ન પર્યાયશક્તિ; બંનેથનું મહત્વ છે, પાણ કાળની નિયામક પર્યાપ્તશક્તિ જ છે. કાળનું બીજું નામ પાણ પર્યાપ્ત જ છે. આ પર્યાયશક્તિ અનંતરપૂર્વકાણવતી પર્યાપ્તિના વ્યયરૂપ અને તત્ત્વસમયની યોગ્યતારૂપ હોય છે. તેથી આ બંનેથની ક્ષાળિક ઉપાદાન સંજ્ઞા છે. આથી ક્ષાળિક ઉપાદાનને કાર્યનું નિયામક કહેવામાં આવ્યું છે.

જે નિકાળી ઉપાદાનને પાણ સામેલ કરીને વાત કરીએ તો આ પ્રમાણે કહેવાશે કે પર્યાપ્તશક્તિ યુક્ત દ્રવ્યશક્તિ કાર્યકારી છે, પરંતુ આમાં પાણ નિયામક કારાણના રૂપમાં તો પર્યાપ્તશક્તિરૂપ ક્ષાળિક ઉપાદાન જ રહ્યું.

જે નિમિત્તને પાણ આમાં સામેલ કરીને વાત કરવી હોય તો આ પ્રમાણે કહી શકાય કે સહકારી કારાણ સાપેક્ષ વિશિષ્ટપર્યાયશક્તિથી યુક્ત દ્રવ્યશક્તિ જ કાર્યકારી છે.

ઉક્ત સંદર્ભમાં જ્યાપુર (ખાનિર્દી) તત્ત્વચર્ચમાં સિદ્ધાન્તાચાર્ય પંડિત ફૂલચંદજીએ અનેક ન્યાયશાસ્ત્રીય પ્રમાણ પ્રસ્તુત કરતાં જે સ્પષ્ટીકરાણ કર્યું છે, તેનો કેટલોક મહત્વપૂર્ણ અંશ આ પ્રમાણે છે -

“શ્રી રાજવાર્તિકમાં કહ્યું છે - યથા મૃદ: સ્વયમન્તર્ઘટ ભવનપરિણામાભિમુખ્યેદણં - ચક્ર - પૌરુષેયપ્રયત્નાદિ નિમિત્તમાત્રં ભવતિ । યત: સત્ત્વપિ દણ્ડાદિનિમિત્તેષુ શર્કરાદિપ્રચિતો મૃત્પિણ્ડ: સ્વયમન્તર્ઘટ ભવનપરિણામનિરુત્સુકત્વાન્ન ઘટો ભવતિ । અતો મૃત્પિણ્ડ એવ બાહ્યદણ્ડાદિનિમિત્ત - સાપેક્ષ અભ્યન્તરપરિણામ સાન્નિધ્યાદ ઘટો ભવતિ ન દણ્ડાદય: ઇતિ દણ્ડાદીનાં નિમિત્તમાત્રત્વમ् ।

અર્થ - જેમ કે માટી સ્વયં અંદરથી ઘટ થવારૂપ પરિણામના સન્મુખ થવાથી દંડ, ચક્ર અને પૌરુષેય પ્રયત્ન આદિ નિમિત્તમાત્ર હોય છે; કારાણકે દંડાદિ નિમિત્તોના રહેવા છતાં પાણ રેતીના ઠગલારૂપ માટીનો પિંડ સ્વયં અંદરથી ઘટ બનવા રૂપ પરિણામ (પર્યાપ્ત) થી નિરત્સક હોવાના (ઘટ

એક અનુશીલન

પર્યાયરૂપ પરિગમન સન્મુખ ન હોવાના) કારણે ઘટ નથી બનતો; તેથી ભાવમાં દંડાદિ નિમિત્ત સાપેક્ષ માટીનો પિંડ જ અંદર ઘટ બનવારૂપ પરિગમનું સાનિધ્ય હોવાથી ઘટ બને છે, દંડાદિ ઘટ નથી બનતા, તેથી દંડાદિ નિમિત્તમાત્ર છે.

આ પ્રેરક નિમિત્તોની નિમિત્તતાનું સ્પષ્ટીકરાગું છે. આ ઉલ્લેખમાં ખૂબ જ સમર્થ શબ્દો દ્વારા એ સ્પષ્ટ કરી દીધું છે કે ન તો સર્વ પ્રકારની માટી ઘટનું ઉપાદાન છે, અને ન તો પિંડ, સ્થાસ, કોશ અને કુસૂલાદિ પર્યાયોની અવસ્થારૂપથી પરિગત માટી ઘટનું ઉપાદાન છે, પરંતુ જે માટી અનન્તર સમયમાં ઘટ-પર્યાયરૂપથી પરિગત થવાવાળી છે, માત્ર તે જ માટી ઘટપર્યાયનું ઉપાદાન છે.

આ જ તથ્ય રાજવાર્તિકના ઉકેલ ઉલ્લેખ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. માટીની આવી અવસ્થા પ્રાપ્ત થતાં તે નિયમથી ઘટનું ઉપાદાન બને છે. આ જ કારણથી તત્ત્વાર્થવાર્તિકના ઉકેલ ઉલ્લેખ દ્વારા એ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યારે માટી ઘટ પર્યાયના પરિગમન સન્મુખ થાય છે; ત્યારે દંડ, ચક અને પૌરુષેય પ્રયત્નની નિમિત્તતા સ્વીકૃત કરવામાં આવી છે, અન્ય કાળમાં તે નિમિત્ત સ્વીકારવામાં નથી આવ્યાં.

આ જ તથ્યને સ્પષ્ટ કરતા પ્રમેયકમલમાર્તણમાં લખ્યું છે -

યच્ચોચ્યતે - શક્તિનિત્યાડનિત્યા વેત્યાદિ । તત્ત્વ કિમયં દવ્યશક્તતૌ પર્યાયે વા પ્રશ્ન: સ્યાત्, ભાવાનાં દ્વયપર્યાયશક્તયાત્મ કત્વાત् । તત્ત્વ દવ્યશક્તિનિત્યૈવ, અનાદિનિધનર્ચવાભાવત્વાદ્ દવ્યસ્ય । પર્યાયશક્તિસ્ત્વ નિત્યૈવ, સાદિપર્યવસાનત્વાત् પર્યાણામ् । ન ચ શક્તેનિત્યત્વે સહકારિકારણનપેક્ષયैવાર્થસ્ય કાર્યકારિત્વાનુષંગः, દવ્યશક્તે: કેવલાયા: કાર્યકારિત્વાનભ્યુપગમાત् । પર્યાયશક્તિ સમન્વિતા હિ દવ્યશક્તિ: કાર્યકારિણી, વિશિષ્ટપર્યાયપરિણતસ્યૈવ દવ્યસ્ય કાર્યકારિત્વપ્રતીતે: । તત્પરિણતિશ્વાર્ય સહકારિકારણાપેક્ષયા ઇતિ પર્યાયશક્તેસ્તદૈવ ભાવાન્ન સર્વદા કાર્યોત્પત્તિપ્રસંગ: સહકારિકારણાપેક્ષાવૈયર્થ્ય વા ।

अने ने ऐम कुहेवामां आवे छे के शक्ति नित्य छे के अनित्य छे वगेरे. तो त्यां शुं आ द्रव्यशक्ति के पर्यायशक्तिना विषयमां प्रश्न छे; कारागु के पदार्थ द्रव्यपर्यायशक्ति स्वइप होय छे. तेमां द्रव्यशक्ति नित्य ज छे; केम के द्रव्य अनादिनिधन स्वभाववाणु होय छे. पर्यायशक्ति तो अनित्य ज छे; केम के पर्याय साइ-सान्त होय छे.

जे ऐम कुहेवामां आवे के शक्ति नित्य छे, तेथी सहकारी कारागुनी अपेक्षा राज्या विना ज कार्यकारीपाणानो प्रसंग आवी जशे - पाण ऐम नथी; केम के मात्र द्रव्यशक्तिनुं कार्यकारीपाणुं स्वीकारवामां नथी आव्युं; परंतु पर्यायशक्तिथी युक्त द्रव्यशक्ति कार्य करवामां समर्थ जने छे; कारागु के विशिष्ट पर्यायथी परिणाम द्रव्यनुं ज कार्यकारीपाणुं प्रतीत थाय छे अने तेनी परिणाम सहकारी कारागुसापेक्षा होय छे; केम के पर्यायशक्ति त्यारे ज थाय छे. तेथी न तो सर्वदा कार्यनी उत्पत्तिनो प्रसंग आवे छे के न तो सहकारी कारागुनी अपेक्षानी व्यर्थता प्राप्त थाय छे.

आ रीते ए ज्ञात थई जवाथी के सहकारी कारागुसापेक्षा विशिष्ट पर्याय शक्तिथी युक्त द्रव्यशक्ति ज कार्यकारिणी मानवामां आवी छे; मात्र उदासीन अने प्रेरक निमित्तोना बणे मात्र द्रव्यशक्तिथी ज द्रव्यमां कार्य नथी थतुं.

जे द्रव्यशक्तिने बाब्यनिमित्तोना जेरे कार्यकारी मानी लेवामां आवे तो चागुथी पाण धउनी उत्पत्ति थवा लागे; कारागु के धउं स्वयं द्रव्य नथी, परंतु ते पुद्गलद्रव्यनी एक पर्याय छे; तेथी धउं पर्यायविशिष्ट पुद्गलद्रव्य बाब्य कारागु सापेक्ष धउना अंकुरादि कार्यइपथी परिणाम थायछे.

जे विशिष्टपर्यायरहित द्रव्य सामान्यथी निमित्तोना बण पर धउना अंकुरादि पर्यायोनी उत्पत्ति मानी लेवामां आवे तो जे पुद्गल चागुइप छे, ते पुद्गल होवाथी, तेनाथी पाण धउइप पर्यायनी उत्पत्ति थवा लागेशे; आथी ने विविध लौकिक प्रमाण आपीने ए सिद्ध करवानो प्रयत्न करवामां आवे छे के ज्यारे नेवा प्रबल निमित्त मणे छे; त्यारे द्रव्यने निमित्तो अनुसार

એક અનુશીલન

પરિગમણું જ પડે છે; તેથી આ કથન આગમાનુકૂળ ન હોવાથી સંગત પ્રતીત થતું નથી.

વાસ્તવમાં મુખ્ય વિવાદ ઉપાદાનનો છે, તેનો જે સમીચીન અર્થ શાંખોમાં આપેલ છે, તેના પર સમ્યક્ દાખિપાત ન કરવાથી જ આ વિવાદ ઊભો થયો છે.

જે આગમાનુસાર વિશિષ્ટપ્રયાયશક્તિ યુક્ત દ્રવ્યશક્તિને અંતરંગ કારાગ અર્થાત્ ઉપાદાનકારાગ સ્વીકારીને કાર્ય-કારાગની બ્યવસ્થા કરવામાં આવે તો આ કોઈ વિવાદ જ ન રહે, કારાગ કે યથાર્થમાં જ્યારે-જ્યારે વિવક્ષિત કાર્યને યોગ્ય વિશિષ્ટ પર્યાયશક્તિથી યુક્ત દ્રવ્યશક્તિ હોય છે, ત્યારે-ત્યારે તે કાર્યને અનુકૂળ નિમિત્ત મળે જ છે - એવો નિયમ છે અને એવું નથી કે નિશ્ચય ઉપાદાન હોય અને નિમિત્ત ન મળે.

આ જ ચાતને અસદ્ભૂત વ્યવહારનયની અપેક્ષાએ એમ કહેવાય છે કે જ્યારે જેવાં નિમિત્ત મળે છે, ત્યારે તેવું કાર્ય થાય છે.”^૧

એક વાત એ પાણ તો છે કે જેમ ત્રિકાળી ઉપાદાન સદા ઉપસ્થિત રહે છે; તેવી જ રીતે જામાન્યતા: નિમિત્ત પાણ સદા ઉપસ્થિત રહે છે; કેમ કે જે રીતે પ્રત્યેક દ્રવ્ય પોતાના કાર્ય માટે ઉપાદાન છે; તે રીતે પ્રત્યેક દ્રવ્ય પરના કાર્ય માટે નિમિત્ત પાણ તો છે.

ધર્મદ્રવ્યરૂપ નિમિત્ત સદા વિદ્યમાન છે, તો શું એના આધારે જીવ અને પુદ્ગલોએ નિરંતર ચાલતા રહેવું જોઈએ ? જે જ પ્રમાણે અધર્મદ્રવ્ય પાણ સદા વિદ્યમાન રહે છે, તો શું જીવ અને પુદ્ગલોએ નિરંતર સ્થિર પાણ રહેવું જોઈએ. એવું કેવી રીતે બની શકે ? કારાગ કે ગમન અને સ્થિતિના નિમિત્તોના સદા વિદ્યમાન રહેવાથી જીવ અને પુદ્ગલ ચાલશે કે સ્થિર રહેશે? પરસ્પર વિસંઘરસ્વભાવવાળી હોવાથી ચાલવું અને સ્થિર થવું બેઠ કિયાઓ એક સાથે તો સંભવ નથી.

૧. જ્યાપુર (ખાનિયા) તત્વગ્યા, પુસ્તક-૨ (હિન્દી) પૃષ્ઠ-૩૮૩-૩૮૫

નિમિત્તોપાદાન

૧૨

તેથી સહજરૂપથી તો એ જ સિદ્ધ થાય છે કે સર્વ જીવ અને પુરુષલ
પોતાની ક્ષાળિક ઉપાદાનગત યોગ્યતાનુસાર ગમન કરે છે અને સ્થિર થાય
છે અને જ્યારે-જ્યારે તે પોતાની યોગ્યતાનુસાર ગમન કરે છે અને સ્થિર
થાય છે, ત્યારે-ત્યારે ધર્મ અને અધર્મ દ્વારા નિમિત્તમાત્ર થાય છે.

આપી આ પ્રમાણે કાર્ય ઉત્પન્ન થવાના કાળનું નિયામક કારણ તો
ઉપાદાનગત યોગ્યતારૂપ ક્ષાળિક ઉપાદાન જ થયું; ત્રિકાળી ઉપાદાન પાણ
નહિ કે નિમિત્ત પાણ નહિ.

પ્રેરણ : શું નિયામક કારણ પાણ અનેક પ્રકારના હોઈ શકે છે ?

ઉત્તર : કેમ નહીં ? અવશ્ય હોઈ શકે છે.

પ્રત્યેક કાર્ય (પર્યાપ્તિ)નું ત્રિકાળી ઉપાદાન એ વાતનું નિયામક છે કે
આ કાર્ય (પર્યાપ્તિ) અમુક દ્વારા તેના અમુક ગુણમાં જ થશે, અન્ય દ્વારા માં
નહીં અને તે જ દ્વારાના બીજા ગુણમાં પાણ નહીં. સમ્યગદર્શનરૂપ કાર્ય આત્મ
દ્વારા અને તેના શબ્દા ગુણમાં જ થશે, પુરુષલાદિ દ્વારો કે આત્માના જ્ઞાનાદિ
ગુણોમાં નહીં.

અનન્તર પૂર્વ કાળવતી પર્યાપ્તિ યુક્ત દ્વારનું વ્યયરૂપ ક્ષાળિક
ઉપાદાન વિધિ (પુરુષાર્થ) નું નિયામક છે. આ ઉપાદાન કારણથી એ
સુનિશ્ચિત થાય છે કે આ કાર્ય આ વિધિથી, આ પ્રક્રિયાથી જ સંપન્ન થાય
છે, અન્ય પ્રકારે નહીં.

તત્ત્વમયની યોગ્યતારૂપ ક્ષાળિક ઉપાદાન કાળનું નિયામક છે. જે
દ્વારા અથવા ગુણમાં જે સમયે જે કાર્યરૂપ પરિણમવાની પર્યાપ્તિ યોગ્યતા
હોય છે; તે દ્વારા અથવા તે ગુણ તે જ સમયે તે જ કાર્યરૂપ પરિણમિત થાય
છે.

કાર્યનું બીજું નામ પર્યાપ્ત અર્થાત્ કાળ પાણ છે, તેથી કાળના નિયામક
તત્ત્વમયની યોગ્યતારૂપ ક્ષાળિક ઉપાદાનને કાર્યનું નિયામક પાણ કહેવાય છે.

આમ એ નિશ્ચિત થયું કે સ્વભાવનું નિયામક ત્રિકાળી ઉપાદાન,
વિધિ (પુરુષાર્થ-પ્રક્રિયા) નું નિયામક અનન્તરપૂર્વ કાળવતી પર્યાપ્તિ યુક્ત

એક અનુશીલન

૧૩

ત્રયરૂપ ક્ષાળિગુક ઉપાદાન અને કાળ અથવા કાર્યનું નિયામક તત્ત્વમયની યોગ્યતારૂપ ક્ષાળિગુક ઉપાદાન થયું.

અહીં એક પ્રેરણ એ પાણ સંભવ છે કે ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય તો ઉદાસીન નિમિત્ત છે, તેથી તે કદાચ નિયામક કારણ ન પાણ હોય, પરંતુ પ્રેરક નિમિત્તના સંબંધમાં તો આમ ન હોવું જોઈએ.

આ આધારે કોઈ કહી શકે કે ઉદાસીન નિમિત્ત ભલે કાંઈ ન કરતા હોય, પરંતુ પ્રેરક નિમિત્ત તો બધું કરે જ છે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં શિક્ષક પુસ્તક અને દીપક-એ નાગેય નિમિત્ત છે; પાણ શિક્ષક પ્રેરક નિમિત્ત છે અને પુસ્તક અને દીપક ઉદાસીન નિમિત્ત છે. દીપક અને પુસ્તકને ભલે ને કર્તા ન કહો, પાણ શિક્ષકને તો કર્તા કહેવા જ પડશે. તે તો સંકિય થઈને પ્રેરાગ આપે છે, સમજવે છે, છતાં પાણ એ વિદ્યાર્થી અભ્યાસમાં પ્રવૃત્ત ન થાય, તો તે તેમને દંડપાણ આપે છે. તેથી પુસ્તક અને દીપકની અપેક્ષાએ શિક્ષકનું સ્થાન જરૂર મહત્વપૂર્ણ છે.

કેમ નહીં; એ વાત તો એકદમ સ્પષ્ટ જ છે કે દીપક અને પુસ્તકની અપેક્ષાએ શિક્ષકની નિમિત્તતા ભિન્ન પ્રકારની છે. આ જ વાતને સ્પષ્ટ કરવા માટે તો નિમિત્તોના ઉદાસીન અને પ્રેરક એવા બે બેદ કરવામાં આવ્યા છે અને એમ બતાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના અભ્યાસમાં પુસ્તક અને દીપક ઉદાસીન નિમિત્ત છે અને શિક્ષક પ્રેરક નિમિત્ત.

અરે ભાઈ ! ઉક્ત વિશ્વેષાગથી તો ઉદાસીન અને પ્રેરક નિમિત્તોમાં પરસ્પર શું અંતર છે ? માત્ર એ જ સ્પષ્ટ થાય છે, કાર્યોત્પત્તિમાં નિમિત્તનું કર્તૃત્વ સિદ્ધ નથી થતું.

આ સંદર્ભમાં ‘ઇષ્ટોપદેશ’ નું નીચેનું કથન દાખલ છે -

“નાજો વિજ્ઞત્વમાયાતિ, વિજો નાજ્ઞત્વમૃચ્છતિ ।

નિમિત્તમાત્રમન્યરસ્તુ, ગતે ધર્માસ્તિકાયવત् ॥૧॥

૧. આચાર્ય પુન્નયાદ : ઇષ્ટોપદેશ શલોક - ૩૫.

अज्ञने उपदेशादि निभितो द्वारा विज्ञ करी शकातो नथी के विज्ञने अज्ञ करी शकातो नथी; ऐम के परपदार्थतो निभितमात्र छे, जेम के स्वयं चालता छव अने पुद्गलोने धर्मास्तिकाय होय छे.”

आ ज वातने स्पष्ट करतां ऐनी संस्कृत टीकामां लाख्यु छे -

‘नन्वेवं बाह्यनिभितक्षेपः प्राप्नोतीत्यत्राह । अन्य पुनर्गुरुविपक्षादि : प्रकृतार्थ समुत्पादभंशयोनिभितमात्रं स्वात्तत्र योग्यतया एव साक्षात्साधकत्वात् ।’

अहीं ऐम शंका थाय के आ प्रमाणे तो बाह्यनिभितोनुं निराकरण ज थहि जशे ऐनो उत्तर ए छे के अन्य जे गुरु आदि तथा शत्रु आदि छे, ते प्रकृत कार्यना उत्पादमां तथा नाशमां इक्त निभितमात्र छे. परमार्थे कोई कार्य थवामां वा भगवामां तेनी योग्यता ज साक्षात् साधक होय छे.”

उक्त कथनथी ए वात ऐकदम स्पष्ट थहि जाय छे के कार्यनुं साधकतम तो तत्समयनी योग्यताइप क्षणिक उपादान कराण ज छे.

प्रेरक अने उदासीन निभितोमां मूणभूत अंतर आ प्रमाणे छे - ईश्वराशक्तिथी रहित अने निष्ठिय द्रव्य उदासीन निभित होय छे अने ईश्वरावान तथा कियावान द्रव्य प्रेरक निभित क्षेवाय छे. धर्मद्रव्य स्वयं चालता छव अने पुद्गलोनी गतिमां निभित होय छे तथा अधर्मद्रव्य गमनपूर्वक स्थिर थतां छव अने पुद्गलोनी स्थितिमां निभित होय छे. आकाशद्रव्य सर्वद्रव्योना अवगाहनमां निभित छे अने काणद्रव्य सर्व द्रव्योना परिणमनमां निभित होय छे.

धर्म, अधर्म, आकाश अने काण- आ यारेय द्रव्य ईश्वराशक्तिथी रहित छे अने निष्ठिय पाण छे; तेथी ते उदासीन निभित क्षेवाय छे.

विद्याथीओने भागावनार शिक्षक ईश्वरावान होवाथी प्रेरक निभित क्षेवाय छे. अने ध्वजने इक्कवामां हवा सक्षिय होवाथी प्रेरक निभित क्षेवाय छे.

१. पं. आशाधरच्छ : ईष्टोपदेश, श्लोक-उपनी संस्कृत टीका.

એક અનુશીલન

૧૫

જે કે ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાળદ્રવ્ય દૂર્ઘાશક્તિથી રહિત અને નિષ્ઠિય હોવાથી ઉદાસીન નિમિત્ત કહેવાય છે. તથા જીવદ્રવ્ય દૂર્ઘાવાન અને કિયાવાન હોવાથી અને પુદ્ગળ કિયાવાન હોવાથી પ્રેરક નિમિત્ત કહેવાય છે; તથાપિ કાર્યોત્પત્તિમાં સર્વ નિમિત્ત ધર્માસ્તકાયની જેમ ઉદાસીન જ છે.

પ્રશ્ન : વિદ્યાર્થીઓના શિક્ષાગુમાં શિક્ષકની ઉપયોગિતાનો ઈન્કાર કરવો હીક નથી. અરે ભાઈ દેશનાલબજ્ય વિના તો કોઈને સમ્પર્કત્વની પ્રાપ્તિ પણ સંભવ નથી. ચારણ ઝડિયારી મુનિરાજેનો ઉપદેશ પામીને તો ભગવાન મહાવીરના જ્ઞાન સિંહની પર્યાયમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરી હતી. એનું જ પરિણામ છે કે તે જીવ આગળ જતાં ભગવાન મહાવીર બન્યો. આપ ઉપદેશરૂપ નિમિત્તનો નિપેધ કેમ કરો છો ?

ઉત્તર : ઉપદેશરૂપ નિમિત્તનો નિપેધ કોણ કરે છે ? નિમિત્તના કર્તૃત્વનો નિપેધ અવશ્ય કરવામાં આવે છે. જેવી રીતે શિક્ષક વિના વિદ્યાર્થીઓનું શિક્ષાગું સંભવિત નથી; તેવી રીતે દીપક અને પુસ્તક વિના પણ શિક્ષાગું સંભવિત નથી. વિદ્યાર્થીઓના શિક્ષાગુમાં શિક્ષક, દીપક અને પુસ્તક બધાની ઉપયોગિતા છે. જે આમ ન હોત તો દીપક શા માટે પ્રગટાવવામાં આવત, પુસ્તકો શા માટે બધાવી પણ અને વિશ્વવિદ્યાલયોની સ્થાપના પણ શા માટે થાત, સાધુઓમાં પણ ઉપાધ્યાયનું પદ શા માટે હોત?

જે નિમિત્તોનો નિપેધ કરવામાં આવો હોત તો જરૂરથી આ પ્રશ્ન ઊભો થાત. અરે ભાઈ ! પણ નિમિત્તોની સત્તાનો ઈન્કાર કોણ કરે છે ? પરંતુ એ પણ વિચારણીય તો છે ને કે એકલા ઉપદેશથી જ આત્મહિત થતું હોત તો ઉપદેશ તો ધારું જીવો સાંભળે છે, બધાનું હિત કેમ થઈ જતું નથી?

એક વર્ગમાં અનેક વિદ્યાર્થીઓ ભાગે છે, તેમને ભાગાવનાર શિક્ષક એક, પુસ્તકો પણ જે જ, દીપક પણ જે જ; તેમ છતાં બધા તો વિદ્યાન બની જતા નથી. સૌ પોત-પોતાની યોગ્યતાનુસાર જ વિદ્યાન બને છે.

એ જ પ્રમાગે એક જ સમોશરાગુમાં એક સાથે અનેક જીવ ધર્મોપદેશ સાંભળે છે; પરંતુ બધાં સમ્યગુદ્ધિટિ, વ્રતી કે સાધુ તો થઈ જતાં નથી; સૌ પોત-પોતાની પર્યાયિગત યોગ્યતાનુસાર જ પરિણમે છે.

તેથી એ સુનિશ્ચિત જ છે કે કાર્યના પ્રતિ નિયામક કારાગ તો પોત-પોતાની પર્યાયિગત યોગ્યતા જ છે.

જ રા વિચાર તો કરો કે ભગવાન મહાવીરના જીવનું હિત મારીચિના ભવમાં જ કેમ ન થઈ ગયું? શું ત્યાં સદ્ગુણિતોની ઊણપ હતી? પિતા ચક્રવર્તી ભરત, ધર્મચક્રના આદિ પ્રવર્તક ભગવાન ઋષભદેવ દાદા, ભગવાન ઋષભદેવના સમવશરાગુમાં તેમનો ઉપદેશ સાંભળીને તો તેણે વિરોધભાવ ઉત્પન્ન કર્યો હતો. શું તેમના ઉપદેશમાં કોઈ ઊણપ હતી? શું ચારાગુંઝદ્વારી મુનિઓનો ઉપદેશ તેમનાથી પાગ સારો હતો?

આનાથી સિદ્ધ થાય છે કે જ્યારે પર્યાયિગત ઉપાદાનની તૈયારી હોય, ત્યારે કાર્ય થાય છે અને તે સમયે યોગ્ય નિમિત્ત પાગ હોય જ છે, તેને શોધવા નથી જવું પડતું.

કૂર સિંહની પર્યાયમાં ધોર વનમાં ઉપદેશનો અવસર કર્યાં હતો? પરંતુ તેનો પુરુષાર્થ જગ્યો તો નિમિત્ત આકાશથી ઊતરીને આવ્યું. એટલે જ તો કહેવાય છે કે આત્માર્થાં નિમિત્તોની શોધમાં વ્યચ ન થવું જોઈએ. ‘નિમિત્ત નથી હોતું’ - એવું કોણ કહે છે? પરંતુ નિમિત્તોને શોધવા પાગ નથી પડતાં. જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય છે ત્યારે તદ્દનુકૂળ નિમિત્ત હોય જ છે.

નિમિત્તોના અનુસાર કાર્ય નથી થતું, કાર્યના અનુસાર નિમિત્ત કહેવામાં આવે છે. વેશ્યાના મૃત શરીરને જોઈને રાગીને રાગ અને વેરાગીને વેરાગ્ય ઉત્પન્ન થાય છે. અને તે વેશ્યા રાગીના રાગ અને વેરાગીના વેરાગ્યનું નિમિત્ત કહેવામાં આવે છે. જે નિમિત્તના અનુસાર કાર્ય થતું હોય તો તેને જોઈને દરેકને કાં તો રાગ જ ઉત્પન્ન થવો જોઈએ કાં તો પછી વેરાગ્ય જ.

આચાર્યકલ્પ પંડિત ટોડરમલજ કહે છે-

એક અનુશીલન

૧૭

“પરદ્વય કોઈને બળાત્કારથી તો બગાડતું નથી, પાણ પોતાના ભાવ બગડે ત્યારે તે પાણ બાધનિમિત છે. વળી એ નિમિત વિના પાણ ભાવ તો બગડે છે. માટે તે નિયમદ્વય નિમિત પાણ નથી.

એ પ્રમાણે પરદ્વયનો દોષ જેવો એ તો મિથ્યાભાવ છે.”^૧

ન તો નિમિત ઉપાદાનમાં બળાત્કારથી કાંઈકરે છે કે ન તો ઉપાદાન કોઈ નિમિતોને બળાત્કારથી લાવી કે મેળવી દે છે. બંનેનો સહજ જ સંબંધ હોય છે. નિમિત-નૈમિત્તિક સંબંધની સહજતા વિષે પંડિત ટોડરમલજીએ આ પ્રમાણે સ્પષ્ટતા કરી છે :-

“ જે કર્મ પોતે કર્તાર્દ્વય થઈ પ્રયત્નપૂર્વક જીવના સ્વભાવને હાગે વા બાધસામગ્રી મેળવી આપે તો કર્મમાં ચૈતન્યપાણું તથા બળવાનપાણું પાણ સંભવે; પાણ એમ તો નથી. કોઈ સહજ જ નિમિત-નૈમિત્તિક સંબંધ છે. જ્યારે તે કર્મનો ઉદ્દ્યકાળ હોય, ત્યારે આત્મા પોતે જ સ્વભાવદ્વય નહિ પરિણામતા વિભાવદ્વય પરિણામે છે તથા જે અન્ય દ્રવ્યો છે, તે પાણ એ જ પ્રમાણે સંબંધદ્વય થઈને પરિણામે છે.

એમ સૂર્યોદયકાલે ચકવા-ચકવીનો સંયોગ થાય છે; ત્યાં કોઈએ દેખબુદ્ધિથી વા બળપૂર્વક રાત્રિવિષે તેમને જુદાં કર્યાં નથી તેમ કોઈએ કર્સાળાબુદ્ધિપૂર્વક દિવસ વિષે લાવીને મેળવ્યાં નથી. સૂર્યસ્તાનું નિમિત પામીને તે સ્વયં જ ધૂટા પડે છે અને સૂર્યોદયનું નિમિત પામીને સ્વયં જ મળે છે. એવો જ નિમિત-નૈમિત્તિક સંબંધ બની રહ્યો છે. એ જ પ્રમાણે કર્મનો પાણ નિમિત-નૈમિત્તિક ભાવ જાગ્રતો.”^૨

નિમિત-નૈમિત્તિક સંબંધ એક સહજ સંબંધ છે, તેને કર્તા-કર્મ સંબંધના રૂપમાં રજૂ કરવો તે ઉચિત નથી. પરની સાથે કારકતાના સંબંધનો નિષેધ કરતાં આચાર્ય અમૃતચંદ્ર લખે છે-

૧. મોખમાર્ગ પ્રકાશક, પૃષ્ઠ - ૨૪૮

૨. મોખમાર્ગ પ્રકાશક, પૃષ્ઠ-૨૮

“अतो न निश्चयतः परेण सहात्मनः कारकत्वसम्बन्धोडस्ति, यतः शुद्धात्मस्वभावलाभाय सामग्रीमार्गणव्यग्रतया परतंत्रैर्भूयते ।”

आथी निश्चयथी परनी साथे आत्माने कारकतानो क्रोध संबंध नथी; तो पाणु शुद्धात्मलाभनी प्राप्ति माटे ज्ञव न आणे केम व्यग्रताथी परतंत्र थाय छे.”

आ ९ वातने स्पष्ट करतां आ ९ गाथाना भावार्थमां लाख्यु छे-

“उपरोक्त प्रकारे द्रव्य स्वयं ९ पोतानी अनंतशक्तिरूप संपदाथी परिपूर्ण छे, तेथी स्वयं ९ ४ कारकरूप थर्दने पोतानुं कार्य करवा माटे समर्थ छे, तेने बाध्यसामग्री कुंठ सहायता करी शकती नथी. तेथी केवलज्ञानना अभिलाषी आत्माए बाध्यसामग्रीनी अपेक्षा राखीने परतंत्र थवुं निरर्थक छे.”

स्वभाव भावोमां तो परनुं कर्तृत्व छे ९ नहीं, विभाव भावोमां पाणु परना कर्तृत्वनो निपेक्ष उत्तरामां आव्यो छे. पंचास्तिकायसंग्रह गाथा ६२नी आर्यार्थ अमृतयंत्रकृत समयव्याख्या नामक टीकामां आ वातने सारी शीते स्पष्ट करवामां आवी छे. टीकाना भावने स्पष्ट करतां भावार्थमां लाखायेल मूण कथन आ प्रमाणे छे-

“आ प्रमाणे पुद्गलनी कर्मोद्यादिरूपथी के कर्मवंधादिरूपथी परिगमित थवानी कियामां वास्तवमां पुद्गल ९ स्वयमेव ४ कारकरूप प्रवर्ते छे; तेथी तेने अन्य कारकोनी अपेक्षा नथी तथा ज्ञवनी ओद्यिकादि भावरूप परिगमित थवानी कियामां वास्तवमां ज्ञव स्वयं ९ ४ कारकरूप प्रवर्ते छे; तेथी तेने अन्य कारकोनी अपेक्षा नथी. पुद्गलनी अने ज्ञवनी उपरोक्त कियाओ ऐक ९ काणमां वर्ते छे; तो पाणु पौद्गलिक कियामां वर्तता पुद्गलना ४ कारक ज्ञवकारकोथी बिलकुल भिन्न अने निरपेक्ष छे तथा ज्ञवभावरूप कियामां वर्तता ज्ञवना ४ कारक पुद्गलकारकोथी बिलकुल भिन्न अने निरपेक्ष छे

એક અનુશીલન

૧૯

વાસ્તવમાં કોઈ દ્રવ્યના કારકોને કોઈ અન્ય દ્રવ્યના કારકોની અપેક્ષા નથી હોતી.”

ઉક્ત કથનથી એ અત્યંત સ્પષ્ટ છે કે આ ભગવાન આત્મા પોતાની સમૃદ્ધિન-જ્ઞાન-ચારિત્રણ નિર્મલપર્યાયો અને રાગાદિર્ણ વિકારી પર્યાયોના રૂપમાં પોત-પોતાની સ્વસમયની યોગ્યતાનુસાર સ્વયં જ પરિણમે છે, એમાં પર(નિમિત)નો કોઈ હસ્તક્ષેપ નથી.

હા, એ અવશ્ય છે કે ત્યારે આ આત્મા સમૃદ્ધિનાં નિર્મલપર્યાયો કે રાગાદ વિકારી પર્યાયોના રૂપમાં પોતાની સ્વભાવગત અને પર્યાયગત યોગ્યતા અનુસાર પરિણમિત થાય છે, ત્યારે તદ્દનુકૂળ નિમિત પાણ હોય જ છે. તેથી એ કથન પાણ અસત્ય નથી કે નિમિત વિના કાર્ય થતું નથી, પરંતુ આ કથન નિમિતની અનિવાર્ય ઉપસ્થિતિ માત્રને જ બતાવે છે, એનાથી વિશેપ કંઈ પાણ નહીં. ધ્યાન રહે કે નિમિતની અનિવાર્ય ઉપસ્થિતિ માત્રથી તેને કર્તા અથવા સાધકતમ કરાગુન માની શકાય.

નિમિત સદા પરપદાર્થર્ણ જ હોય છે. જેમ કે નીચેના કથનથી સ્પષ્ટ છે-

“ઉપાદાન નિજગુણ જહી, તહી નિમિત પર હોય.”

નિમિતને કર્તા અથવા સાધકતમ કરાગુન માનવાથી એક દ્રવ્યનો કર્તા બીજાને માનવાથી દ્રવ્યની સ્વતંત્ર સત્તાનો વ્યાધાત થાય છે.

ઉક્ત સંદર્ભમાં જૈનતત્વમીમાંસાનું નીચેનું કથન દ્રષ્ટવ્ય છે-

“જે કેવળ બાખ નિમિતો અનુસાર વસ્તુઓની-પ્રત્યેક પર્યાયની ઉત્પત્તિ માનીએ તો પ્રત્યેક વસ્તુને સ્વરૂપથી જ પરતંત્ર માનવાનો પ્રસંગ ઉપસ્થિત થાય છે. અને એવી અવસ્થામાં જીવોની સ્વાત્રિત બંધ-મોક્ષ વ્યવસ્થા, પરમાણુઓ, ધર્માદિ ચાર દ્રવ્યોની સ્વભાવપર્યાયો તથા અભવ્યો અને દૂરાન્દૂર ભવ્યોનું નિરંતર સંસારી બની રહેવું નહીં બની શકે.

૧. બનારસીદાસ : ઉપાદાન-નિમિત દોષા, દોષા-૪

તેથી પ્રત્યેક દ્રવ્યમાં તેમના પોત-પોતાના સ્વભાવ આદિના કારાગુસ્વરૂપ એવી વ્યવસ્થા હોવી જોઈએ, જેના કારાગે પ્રત્યેક સમયનો ઉત્પાદ-વ્યાય સ્વયં થાય છે. પ્રત્યેક સમયના પૃથ્વે-પૃથ્વેને વસ્તુનિષ્ઠ કારાગ છે, તેની જ આગમમાં નિશ્ચય ઉપાદાન સંજ્ઞા સ્વીકારવામાં આવી છે.^૧

આથી એ સ્પષ્ટ થાય છે કે પ્રતિ સમયના પ્રત્યેક કાર્યનું નિશ્ચય ઉપાદાન સુનિશ્ચિત છે. આ સુનિશ્ચિત વ્યવસ્થાનો આપણા ઈન્દ્રિય પ્રત્યક્ષ, તર્ક અને અનુભવના આધારે અપલાપ કરવો તે એક દ્રવ્યાશ્રિત કાર્ય-કારાગભાવને જ નેસ્તનાબૂદ કરવા બરાબર છે. હું તો આને આગમની અવહેલના કરવા રૂપ સૌથી મોટો અપરાધ માનું છું^૨.

પ્રત્યેક દ્રવ્ય સ્વભાવથી જ પરિણમનશીલ છે. જે નિત્ય રહીને પાણ નિરંતર પરિણમિત થવાનો પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ છે તો પછી તેને પોતાના પરિણમનમાં પરદ્રવ્યની અપેક્ષા જ કેમ હોય? કેમ કે સ્વભાવ તો નિરપેક્ષ જ હોય છે. જે પરની અપેક્ષા રાખતો હોય, તેને સ્વભાવ કેવી રીતે માની શકાય?

નિમિત્તોને અંતરંગ નિમિત અને બહિરંગ નિમિતના રૂપમાં પાણ વળ્ણિકૃત કરવામાં આવે છે. મુખ્ય નિમિત્તોને અંતરંગ નિમિત અને ગૌણ નિમિત્તોને બહિરંગ નિમિત કહેવામાં આવે છે. કર્મબંધનમાં આત્માના રાગાદિભાવોને અંતરંગ નિમિત અને મન-વચન-કાયના વ્યાપારને બહિરંગ નિમિત કહેવામાં આવે છે. એ જ પ્રમાણે પદાર્થોના જ્ઞાનમાં જ્ઞાનાવરણી કર્મના ક્ષયોપશમને અંતરંગ નિમિત અને ઈન્દ્રિયો, પ્રકાશ આદિને બહિરંગ નિમિત કહેવામાં આવે છે. સમ્યગુર્ધનની પ્રાપ્તિમાં દર્શનમોહનીય કર્મના ક્ષય, ક્ષયોપશમ, ઉપશમને અંતરંગ નિમિત અને ગુરુ-ઉપદેશને બહિરંગ નિમિત કહેવામાં આવે છે.

નિમિત બબે અંતરંગ હોય કે બહિરંગ, પરંતુ છે તો તે નિમિત જ, કાર્યની ઉત્પત્તિમાં સર્વ નિમિતોની સ્થિતિ લગભગ એક સમાન જ છે; તેથી કોઈપણ નિમિત કર્તૃને સાધકતમકરણ હોઈ શકે નહિં.

૧. જેન તત્ત્વ મીમાંસા (હિન્દી), પૃષ્ઠ-૭૭

૨. જેન તત્ત્વ મીમાંસા (હિન્દી), પૃષ્ઠ-૭૯

એક અનુશીલન

૨૧

જે કે આત્માના રાગાદિભાવો અને કર્મોના ઉદ્ય, ક્ષય, ક્ષયોપશમ તથા ઉપશમને અંતરંગ નિમિત્તના રૂપમાં જ નિરૂપિત કરવામાં આવે છે; તો પાણ એના સંદર્ભમાં આચાર્ય અમૃતચંદ્રનું નીચેનું કથન દ્રષ્ટવ્ય છે-

“જીવકૃતં પરિણામં નિમિત્તમાત્રં પ્રપદ્ય પુનરન્યે ।

સ્વયમેવ પરિણમન્તેડત્ત્ર પુદ્ગલાઃ કર્મભાવેન ॥

પરિણમમાનર્ય ચિતશિચદાત્મકૈ: સ્વયમપિ સ્વકૈભવિ : ।

ભવતિ હિ નિમિત્તમાત્રં પૌદ્ગલિકં કર્મ તર્સ્યાપિ ॥૧

જીવકૃત રાગાદિ પરિણામોનું નિમિત્તમાત્ર પામીને જીવથી બિન્ન અન્ય પુદ્ગલ સંબંધ પોતાની મેળે જ જ્ઞાનાવરાગાદિ કર્મો રૂપ પરિણમી જાય છે. એ જ પ્રમાણે રાગાદિભાવો રૂપ સ્વયં જ પરિણમિત થતા આત્માને પુદ્ગલ કર્મનો ઉદ્ય નિમિત્ત માત્ર જ છે.”

ઉત્તે કથનમાં આચાર્ય અમૃતચંદ્રએ ‘સ્વયમેવ પરિણમન્તે’ પદ વારા એ સ્વપ્ન કરી દીધું છે કે પ્રત્યેક પદાર્થ પોતાના ઉપાદાનની યોગ્યતાનુસાર સ્વયં જ પરિણમિત થાય છે, તેના પરિણમનમાં અન્ય પદાર્થ તો માત્ર નિમિત્ત જ હોય છે.

આ સંદર્ભમાં નીચેનું કથન પાણ દ્રષ્ટવ્ય છે-

“પ્રકૃત માં એમ સમજવું જોઈએ કે જેને આગમમાં નિમિત્ત કહેવામાં આવ્યું છે. તે પરમાર્થથી અન્યના કાર્યની ઉત્પત્તિમાં રંચમાત્ર પાણ સહાયતા કરતું નથી, તેમ છતાં તેની સહાયતા વિના કાર્ય થઈ શકતું જ નથી - એમ માનવું તે જ અધ્યવસાન ભાવ છે. આનો પ્રત્યેક વસ્તુ પોતાના કાર્યકાળમાં સ્વયં નિષેધ કરે છે, કારણ કે જેટલી જરૂર-ચેતન વસ્તુઓ છે, તેમના પરિણમ પરની અપેક્ષા કર્યા વિના સ્વયં જ થાય છે. તો પાણ બિન્ન સતતાના બે દ્રવ્યોમાં જે વિશેષાગ-વિશેષભાવ, નિમિત્ત-નેમિત્તિક અને આધાર-આધેય સંબંધ માનવામાં આવેલ છે, તે માત્ર અસંદ્ભૂત વ્યવહારનયથી માનવામાં આવેલ છે. પરમાર્થથી એમનામાં કોઈ સંબંધ નથી.

૧. આચાર્ય અમૃતચંદ્ર : પુરુષાર્થ સિદ્ધયુપાય, ખ્લોક ૧૨-૧૩

તેથી જ્ઞાન પાગ આગમમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ નામક ચારિત્ર મોહનીય કર્મના ઉદ્યથી જીવમાં કોધની ઉત્પત્તિ થાય છે, તો ત્યાં તેને કાળ પ્રત્યાસત્તિવશ કરવામાં આવેલ ઉપચારિત કર્થન જ જાગુવું જોઈએ. અર્થાત् તે સમયે ચારિત્રમોહનીય કર્મના ઉદ્યથી નિરપેક્ષ રહીને કોઈ નામક ચારિત્રમોહનીય પરિણામ સ્વયં જ ઉત્પન્ન થયું, ન તો તે કર્મ કોધની ઉત્પત્તિમાં પરમાર્થથી સહાયક થયું કે ન તે કોધભાવ પાગ ઉક્ત કર્મના ઉદ્યમાં પરમાર્થથી સહાયક થયો. બંનેએ એક-બીજાની અપેક્ષા રાખ્યા વિના જ પોત-પોતાના પરિણામ કર્યાં. તો પાગ કાળ-પ્રત્યાસત્તિવશ પ્રયોજન વિશેપને ધ્યાનમાં રાખીને આ અસદ્ભૂત વ્યવહાર કરવામાં આવે છે કે કોઈ કર્મના ઉદ્યથી કોધભાવ થયો છે.^૧

આશય એ છે કે ઉપાદાનમાં કાર્યરૂપ પરિણમવાની યોગ્યતા હોય ત્યારે તે સ્વયં કાર્યરૂપ પરિણમે છે અને તે સમયે તેમાં બાધ્યસામગ્રી નિમિત્ત હોય છે; કેમ કે નિમિત્તપાગાને ગ્રાપ્ત થયેલ બાધ્યસામગ્રી અને ઉપાદાનભૂત દ્રવ્યના કાર્યમાં નિયમથી બાધ્યવ્યાપ્તિ હોય છે, આને જ કાળ-પ્રત્યાસત્તિ કહે છે.

જો બાધ્યસામગ્રીમાં કારાગતા ભૂતાર્થ માનવામાં આવે તો જેવી રીતે પોપટ પોતાની સહજ યોગ્યતાવશ બાધ્યસામગ્રીના સદ્ભાવમાં બોલવા લાગે છે; તેવી રીતે સહજ યોગ્યતાના અભાવમાં પાગ બાધ્યસામગ્રીના બળે બગલાએ પાગ બોલવા લાગવું જોઈએ, પરંતુ લાખ પ્રયત્ન કરવા છતાં પાગ બાધ્યનિમિત્તના બળે બગલો નથી બોલી શકતો અને પોપટ બોલી શકે છે. આથી માલુમ પડે છે કે બાધ્યસામગ્રી તો કાર્યમાં નિમિત્તમાત્ર છે; જે પાગ કાર્ય થાય છે, તે (કાર્ય) દ્રવ્યમાં પર્યાયગત યોગ્યતાના ગ્રાપ્ત થવાથી જ થાય છે.

૧. જેન તત્ત્વ સમીક્ષાનું સમાધાન (હિન્દી) પૃષ્ઠ-૫૬

એક અનુશીલન

૨૩

આ જ કારણે ભડીકલંકદેવે દૈવનું લક્ષાગું બતાવતાં પોતાની અધ્યાત્મી ટીકામાં લાખું છે કે પુરાકૃતં કર્મ યોગ્યતા ચ દૈવમ् અર્થાત् પહેલા કરવામાં આવેલું કર્મ અને યોગ્યતા એ બંનેને દૈવ કહે છે.

જુઓ, ૧૪માં ગુગુસ્થાને અસાતાવેદનીયનો ઉદ્ય તો છે, પરંતુ તેદ્વન્ય હુંઘ અને તેનું વેદન નથી; કારણ કે તે સમયે તે જીવમાં દ્રવ્ય-પર્યાપ્ત યોગ્યતા નો અભાવ થઈ ગયો છે. તેથી એ સિદ્ધાત ફલિત થાય છે કે બાલ્યસામથીનો સદ્દભાવ કે કિયાશીલતા કાર્યની નિયામક નથી હોતી. ઉપાદાનગત દ્રવ્ય-પર્યાપ્ત યોગ્યતા જ કાર્યની નિયામક હોય છે; કારણ કે આવા ઉપાદાનના અનંતર સમયમાં નિયમથી કાર્યની ઉત્પત્તિ જોવા મળે છે.^૧

તેથી નિષ્કર્ષના રૂપમાં એમ સમજનું જોઈએ કે પ્રતેક દ્રવ્ય નિત્યતાની સાથે સ્વયં પરિણામસ્વભાવી હોવાથી પોતાનું કાર્ય સ્વયં જ કરે છે-આ યથાર્થ છે. કાર્યના થવામાં જે નિમિત્તતા સ્વીકાર કરવામાં આવી છે; તે અસદ્ભૂત વ્યવહારન્યથી જ સ્વીકારવામાં આવી છે, પરમાર્થથી નહીં.

તેથી નિશ્ચયનયનું કથન સમ્યક એકાંતરૂપ હોવા છતાં પાણ તેનાથી અનેકાંતની જ પ્રતિષ્ઠા થાય છે. જ્યારે અસદ્ભૂત વ્યવહારન્યના કથન અનુસાર પરની સહાયતાને યથાર્થ માનતાં પરમાર્થથી તે અનેકાંતનું ધાતક જ સિદ્ધ થાય છે.^૨

ઉપર્યુક્ત સંપૂર્ણ વિવેચનથી ‘કાર્યોત્પત્તિમાં ઉપાદાન અને નિમિત્તનું શું સ્થાન છે’ - એ વાત અત્યંત સ્પષ્ટ થઈ જાય છે. પક્ષવામોહથી દૂર રહીને વિચાર કરતાં વિવાદને માટે કોઈ સ્થાન રહેતું નથી. નિનવાણીનું ઊંડાગથી અધ્યયન ન કરવું તે જ તાત્ત્વિક વિવાદોનું મૂળ કારણ છે. તેથી તાત્ત્વિક વિવાદોથી બચવાનો એક માત્ર ઉપાય નિનવાણીનો ઊંડાગથી સ્વાધ્યાય કરવો તે જ છે. માત્ર તાત્ત્વિક વિવાદોના ઉકેલ માટે જ નહીં પરંતુ આત્મકલ્યાણ માટે પાણ પ્રાથમિક અવસ્થામાં નિનવાણી જ પરમશરાણ છે.

૧. જેનતત્ત્વ સમીક્ષાનું સમાધાન, (હિન્દી) પૃષ્ઠ ૧૦૮

૨. જેન તત્ત્વ સમીક્ષાનું સમાધાન, (હિન્દી) પૃષ્ઠ ૧૨૮.

દ્વિતીય ખંડ

નિમિત્તોપાદાન : કેટલાક પ્રશ્નોત્તર

આગમ અને પરમાગમના આલોકમાં કરવામાં આવેલ ઉકેલ અનુશીલનમાં નિમિત્ત-ઉપાદાનનું સ્વરૂપ જો કે ખૂબ સ્પષ્ટ થઈ ગયું છે; તો પાણ કેટલાક પ્રશ્ન આત્માધીઓના ચિનને આંદોલિત કરતા જ રહે છે. આ પ્રશ્નોના યથાસંભવ ઉત્તર પાણ જે આગમ અને પરમાગમના આધારે આપી શકાય તો અસંગત નહીં થાય.

આમ વિચારીને જ આ પ્રશ્નોત્તર ખંડમાં કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોના સંદર્ભમાં ઊદાહરણ અપેક્ષિત છે.

(૧) પ્રશ્ન : જેમ જ્યાં સુધી પુત્ર ન થાય, ત્યાં સુધી કોઈને પિતા કહેવું સંભવ નથી; તેવી રીતે જ્યાં સુધી કાર્ય ન થાય, ત્યાં સુધી કોઈને કારાગ કહેવું પાણ સંભવ નથી; કેમ કે કાર્ય વિના કારાગ કોનું ? પુત્ર વિના પિતા કોના ?

આવી સ્થિતિમાં વિચારાણીય બાબત એ છે કે સમ્યગ્દર્શનરૂપ કાર્ય તો કરાગુલબિધના પાણ પછી થાય છે અને દેશનાલબિધરૂપ કારાગ તેના ધારણા સમય પહેલાં થાય છે. ઓછામાં ઓછું અનતમુહૂર્ત પહેલા તો થાય જ છે અને વધારેમાં વધારે તો ભવપરિવર્તન (દેહ પરિવર્તન) પાણ હોઈ શકે છે; કારાગ કે એમ પાણ જેવા મળે છે કે દેશના પૂર્વભવમાં પ્રાપ્ત થઈ હોય અને સમ્યગ્દર્શન ઉત્તરભવ (એટલે કે પછીના ભવ) માં ઉત્પન્ન થાય. એ સમ્યગ્દર્શનને જ નિસર્જિત સમ્યગ્દર્શન કહે છે.

આમ છે તો પ્રશ્ન એ છે કે જે કાર્ય થયા પછી જ કોઈને કારાગ માની શકાય તો પછી સમ્યગ્દર્શનરૂપ કાર્યનું નિમિત્તકારાગ દેશનાલબિધને અથવા ગુરુ-ઉપદેશને કેવી રીતે કહી શકાય ?

ઉત્તર : જે કે એ સત્ય છે કે કાર્ય વિના કોઈને કારાગ કહેવું સંભવ નથી, પુત્ર વિના કોઈને પિતા કહેવું સંભવ નથી; તો પાણ કાર્યના પૂર્વે કારાગની સત્તાનો તો ઈન્કાર કરી શકતો નથી; કારાગ કે પુત્ર થવા પહેલાં પાણ પિતાની સત્તા તો હતી જ, ભલે ને તેમને પિતા કહેવું સંભવ ન હોય.

ઉપદેશને નિમિત્તકારાગ પાણ ત્યારે જ કહેવાશે કે જ્યારે તે ઉપદેશથી કોઈને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય; કારાગ કે તે સમ્યગ્દર્શન રૂપ કાર્યનું જ તો તે કારાગ કહેવાશે. જે કોઈને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ જ ન થાય તો તે ઉપદેશને કોનું કારાગ કહેવાશે ?

આ બધું હોવા છતાં પાણ જ્યારે કોઈને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે; ત્યારે ઉપદેશની પ્રાપ્તિરૂપ નિમિત્ત નિયમથી તેના પૂર્વે જ હોય છે, તે સમયે નહીં. એથી જ સાબિત થાય છે કે ઉપદેશરૂપ નિમિત્તકારાગ તો કાર્ય થયા પહેલાં જ હોય છે, તે સમયે નહીં ભલે ને તેમે તેને કારાગ ત્યારે કહો કે જ્યારે કાર્ય થઈ જય.

અહીં એ વાત પાણ ધ્યાન દેવા યોગ્ય છે કે અન્ય કાર્યોની જેમ સમ્યગ્દર્શનરૂપ કાર્યના નિમિત્ત પાણ બે પ્રકારના હોય છે - અંતરંગ અને બહિરંગ. અંતરંગ નિમિત્ત તો દર્શનમોહનીય કર્મનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમરૂપ અભાવ છે અને બહિરંગનિમિત્ત છે ઉપદેશની પ્રાપ્તિ. અંતરંગ નિમિત્ત તો કાર્યોત્પત્તિના કાળમાં જ વિઘમાન છે; પરંતુ દેશનાલભિન્નરૂપ બાચનિમિત પહેલાં જ થઈ ચૂક્યું છે. એવો કોઈ નિયમ નથી કે જેના અનુસાર અંતરંગ અને બહિરંગ બંને નિમિત્ત કારાગનું કાર્યોત્પત્તિના કાળમાં ઉપસ્થિત રહેવું અનિવાર્ય જ હોય.

(2) પ્રશ્ન : જે એમ છે તો પદ્ધતિ એવું કેમ કહેવાય છે કે ઉપદેશને કારાગ ત્યારે જ કહીશું કે જ્યારે સમ્યગ્દર્શનરૂપ કાર્ય ઉત્પન્ન થઈ જય ?

ઉત્તર : એટલા માટે કે એવો કોઈ નિયમ નથી કે ઉપદેશ શ્રવાગુથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ જ જય, થાય પાણ ખરી અથવા ન પાણ થાય. આ

જ વાતને સ્વપ્ન કરવા માટે એવું કહેવાય છે કે ઉપદેશને કારણ ત્યારે કહીશું કે જ્યારે સાંભળવાવાળાને સમૃદ્ધશર્ણની પ્રાપ્તિ થઈ જાય.

ખરેખર વાત એમ છે કે એવો તો નિયમ છે કે જ્યારે કોઈને સમૃદ્ધશર્ણની પ્રાપ્તિ થાય તો તેના પૂર્વે તેને દેશનાલભિની પ્રાપ્તિ પાણ અવશ્ય હોય જ; પાણ એવો નિયમ નથી કે દેશનાલભિની પ્રાપ્તિ જતાં નિયમથી સમૃદ્ધશર્ણ થાય જ. આ જ કારણે દેશનાલભિની પહેલેથી વિઘમાન હોવા જતાં પાણ તેનું કથન કાર્યોત્પત્તિ થયા બાદ જ કરવામાં આવે છે.

(૩) પ્રેરણ : જો એમ છે તો પછી તીર્થકરો, સાધુ-સંતો અને જ્ઞાનીઓની દેશનાને નિમિત્ત કારણ કહેવાય કે નહીં ? શાશ્વોમાં તો આ બધાને સમૃદ્ધશર્ણનું નિમિત્તકારણ કહેવામાં આવ્યું છે. નિનબિંબ દર્શનને પાણ સમૃદ્ધશર્ણનું નિમિત્ત કહેલ છે.

ઉત્તર : સામાન્યપાણે તો તીર્થકરો, સાધુ-સંતો નથા જ્ઞાનીઓના ઉપદેશ અને નિનબિંબ દર્શનાદિને સમૃદ્ધશર્ણનું નિમિત્ત કહેવાય જ છે અને કહેવાવું પાણ જોઈએ; પરંતુ તે કારણ છે કોને, એને જ ને કે જેને સમૃદ્ધશર્ણની પ્રાપ્તિ થઈ હોય. તેથી જ્યારે તેમના નિમિત્તથી કોઈ વ્યક્તિ વિશેપને સમૃદ્ધશર્ણની પ્રાપ્તિ થાય છે; ત્યારે તે સમૃદ્ધશર્ણનૃપ કાર્યનું કારણ તેમના ઉપદેશને કહેવામાં આવે છે. સામાન્ય અને વિશેપ કંથનમાં આ અંતર પડે જ છે.

(૪) પ્રેરણ : નિનબિંબ દર્શનને સમૃદ્ધશર્ણનું નિમિત્ત કહેવામાં આવેલ છે, પરંતુ કોઈ કામી વ્યક્તિને નિનબિંબની નગનદશા જોઈને કામભાવની ઉત્પત્તિ થઈ જય તો શું તે નિનબિંબને વિકારોત્પત્તિનું નિમિત્ત પાણ કહેવાશે ?

ઉત્તર : ભાઈ, વાત એમ છે કે નિનબિંબ તો મુજબપાણે સમૃદ્ધશર્ણ કે વેરાણનું જ નિમિત્ત હોય છે અને એટલા માટે જ તેમની સ્થાપના પાણ

કરવામાં આવે છે; તેમ ઇતાં કોઈ કામીને તેમને જોઈને કામભાવની ઉત્પત્તિ થઈ ગઈ હોય, તો નિમિત્ત-ઉપાદાન મીમાંસામાં તો તેને બહિરંગ નિમિત્ત કહેવાશે જો; પરંતુ સામાન્યપાણે નિનબિંબને સમૃદ્ધશન-જ્ઞાન-ચારિત્રનું જો નિમિત્ત કહેવાય છે.

સામાન્ય કથન અને વિશેષ કથનના અંતરને જાગ્રવું જોઈએ. એમ તો વેશ્યાને વિકારનું જો નિમિત્ત માનવામાં આવેલ છે. પરંતુ કોઈને વેશ્યાની વૃત્તિ જોઈને વૈરાગ્ય થઈ જાય તો શું વેશ્યાઓને વૈરાગ્યનું નિમિત્ત માનીને તેમને ધર્મસ્થાનોમાં સ્થાન આપાશે ?

નહીં, કદાપિ નહીં; ધર્મસ્થાનોમાં તો વૈરાગ્યના નિમિત્તોના રૂપમાં વીતરાગી નિનબિંબોને જો સ્થાપિત કરાય છે અને કરાતા રહેશે.

(૫) પ્રશ્ન : આપ ભલે કહો કે ન કહો, પરંતુ તે વેશ્યા વૈરાગ્યનું નિમિત્ત તો બની જો ગઈ. એ જો પ્રમાણે તે વીતરાગી નંન હિગંબર નિનબિંબ પાણ વિકારનું નિમિત્ત બની ગયું.

ઉત્તર : તે કાર્યમાં તેની નિમિત્તતાનો કોણ નિપેખ કરે છે; પાણ જ્યારે સદનિમિત્તોની સંગતિમાં રહેવાની વાત કહેવાશે તો વૈરાગ્યને માટે જ્ઞાની ધર્મત્વાઓની સંગતિમાં રહેવાનો જો ઉપદેશ આપવામાં આવશે; કોઈ વેશ્યાની સંગતિમાં રહેવાનો નહીં.

મુખ્યપાણે તો સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ જો વૈરાગ્યમાં નિમિત્ત હોય છે, વેશ્યાદિક નહીં. વેશ્યાનું વૈરાગ્યમાં નિમિત્ત બની જવું એ તો એક અપવાદ છે. અપવાદો અનુસાર જગતનો વ્યવહાર નથી ચાલતો.

તેના ઉપાદાનની જોરદાર તૈયારી હોય, તેના માટે વેશ્યા પાણ વૈરાગ્યનું નિમિત્ત બની જાય છે. આવી ઘટનાઓથી વેશ્યારૂપ નિમિત્તની મહિમા ન આવવી જોઈએ, પરંતુ ઉપાદાનની વિશેષતા સમજમાં આવવી જોઈએ, ક્ષાળિક ઉપાદાનનો મહિમા આવવો જોઈએ.

વાસ્તવમાં કાર્ય તો ઉપાદાનની પર્યાયગત યોગ્યતા અનુસાર જ સંપર્ન થાય છે; નિમિત્તની તો માત્ર અનુકૂળતાના રૂપમાં ઉપસ્થિત જ રહે છે.

જિનાગમમાં નિમિત્તોનું કથન અનેક પ્રકારે જોવા મળે છે. પાણ દરેક જગ્યાએ તેની અપેક્ષા સમજવી જોઈએ, નહિ તો ચિત્તમાં અનેક ભ્રમ પેદા થઈ શકે છે. ચિત્તમાં અનેક પ્રકારના ભ્રમ પેદા ન થાય તથા વૃત્તિમાં ચંચળતા ન આવે; એના માટે નિમિત્ત-ઉપાદાનનું સ્વરૂપ ઊંડાગથી સમજવું જોઈએ.

(૬) પ્રેરણ : આ વિષય તો બહુ અધરો લાગે છે. આ બધા તો વિદ્બાનોને સમજવાના વિષય છે. સામાન્ય જનતાને નિમિત્ત-ઉપાદાનથી શું લેવા-દેવા ?

ઉત્તર : એમ તો બધા વિષયોને સમજવામાં થોડી-ધાર્થી મુશ્કેલી તો પડે જ છે. કોઈ પાણ વિષય કેમ ન હોય, જ્યાં ચુંધી તેના ઊંડાગમાં નહીં જઈએ, ત્યાં ચુંધી તે સમજમાં નહીં આવે. આપાણે એમ જ હાલતા-ચાલતાં કોઈ વિષયને સમજવા ઈચ્છાએ તો એમ તો સંભવ નથી; પરંતુ એવું પાણ નથી કે આપાણે ઉપયોગને થોડો સૂક્ષ્મ કરીએ છતાં આ વિષય સમજમાં ન આવે. ઉપયોગને સૂક્ષ્મ કરીને રૂચિપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ તો આ વિષય પાણ બધાની સમજમાં આવી શકે છે.

એમ વિચારવું જ સૌથી મોટી બાધા છે કે આ તો વિદ્બાનોનો વિષય છે સામાન્ય જનતાને એનાથી શું લેવા-દેવા ? શું સામાન્ય જનતાને પોતાનું કલ્યાણ નથી કરવું ? જો તેને પોતાનું કલ્યાણ કરવું હોય તો તેને પાણ આ બહું સમજવું જ પડશે.

જો આત્મકલ્યાણ સાથે આનો સંબંધ ન હોય તો પછી વિદ્બાન પાણ એને સમજવામાં પોતાનો સમય શા માટે ખરાબ કરે ? શું તેમના સમયની કાઈ કિંમત નથી કે તેઓ પોતાનો સમય અનાવશ્યક અનુપયોગી વિષયોની માથાકૂટમાં બરબાદ કરે ?

આત્મકલ્યાણ કરવા માટે આ વિપયને સમજવો અત્યંત આવશ્યક છે. આને સમજવા વગર આત્મકલ્યાણનો માર્ગ પ્રશસ્ત થતો નથી. કરણુંસાગર આચાર્યાને નિનવાણીમાં આ વિપયનું વિવેચન મુક્તિમાર્ગમાં અત્યંત ઉપયોગી જાગુને જ કર્યું છે. તેથી એને સમજવું થોડું-ધારું અધરં લાગે તો તેથી ગભરાણું ન જોઈએ, ગભરાઈને તેને એમ ને એમ મૂકી દેવું ન જોઈએ. તેને સમજવામાં પીછેહઠન કરવી જોઈએ; બલ્કે આ વિપયને અત્યંત ઉપયોગી જાગુને એને સમજવામાં પૂરી શક્તિ લગાવવી જોઈએ, સમય લગાવવો જોઈએ, ઉપયોગ લગાવવો જોઈએ.

(૭) પ્રશ્ન : આપ જ તો કહો છો કે જે પોતાનું કલ્યાણ કરવું હોય તો આત્માને જાણો, ઓળખો અને તેમાં જ જમી જાઓ લીન થઈ જાઓ; કારણ કે સુખી થવાનો એકમાત્ર એ જ ઉપાય છે. એમાં નિમિત્ત-ઉપાદાન વિષે સમજવાની શું જરૂર છે. ?

ઉત્તર : આત્માનું કલ્યાણ પાણ એક કાર્ય છે, પોતાને જાગુવો ઓળખવો એ પાણ એક કાર્ય છે, પોતામાં જમી જવું-લીન થવું એ પાણ એક કાર્ય છે; અને કોઈપણ કાર્ય કારણ વગર સંપત્તન નથી થતું. નિમિત્ત અને ઉપાદાન કારણોના જ પ્રકાર છે. તેથી આત્મકલ્યાણને માટે, પોતાને જાગુવા ઓળખવા માટે, પોતાનામાં જમી જવા-લીન થવા માટે તેનું સ્વરૂપ સારી રીતે જાગુવું અત્યંત જરૂરી છે.

નિમિત્ત અને ઉપાદાનનું વાસ્તવિક સ્વરૂપ નહીં સમજવાના કારણે આત્મકલ્યાણરૂપ કાર્ય કરવા માટે પાણ આ આત્મા પરપદાર્થોના સહયોગની આકાંક્ષાથી પર તરફ જ દસ્તિ કરે છે; પોતાની તરફ જેતો પાણ નથી. તેથી એ સમજવું અત્યંત જરૂરી છે કે પોતાના આત્માના કલ્યાણનું કાર્ય તો પોતાના આશ્રયથી, પોતાની પાત્રતાથી, પોતાનામાં જ સંપત્તન થાય છે; પરપદાર્થ તો તેમાં માત્ર નિમિત્ત જ હોય છે.

જ્યારે દ્વય સ્વભાવમાં પર્યાયગત પાત્રતાનો પરિપાક થાય છે ત્યારે નિમિત્ત પાણ સહજ જ ઉપસ્થિત રહે છે. તેથી નિમિત્તો પરથી દસ્તિ હટાવીને

त्रिकाळी उपादान के जे निज त्रिकाळी ध्रुव परमात्मा छे; तेना पर दण्डने केन्द्रित करवी ते ज आत्मानुभवनो मार्ग छे.

आ कार्य पाण पर्यायगत योग्यताना सद्भावमां सहजभावथी ज संपन्न थाय छे; एना माटे पाण आकृणता करवाथी कोई कार्य थतुं नथी; प्रत्येक कार्य स्वकालमां स्वयंनी योग्यतारूप उपादानकाराशयी ज संपन्न थाय छे अने ज्यारे कार्य थाय छे त्यारे तदनुकूण निमित्त पाण होय ज छे, तेने शोधवा नथी जवुं पडतुं.

आ प्रमाणे आत्मकल्याणरूप कार्यमां निमित्त-उपादाननी संधिनुं सम्यक्ष्वान थां दण्ड परपदार्थों परथी हटीने स्वभाव-सन्मुख थाय छे अने आत्मानुभूति प्रगट थाय छे. आत्मानुभूतिना कालमां निश्चय सम्बद्धर्थन-शान-चारित्रनी उत्पत्तिरूप मोक्षमार्ग प्रगट थाय छे.

(८) प्रश्नः जे प्रत्येक कार्यनी उत्पत्तिमां उपादाननी साथे-साथे निमित्त पाण होय ज छे, तो तेना तरइ ध्यान केम न आपवुं, तेनी शोध केम न करवी ?

उत्तरः ज्यारे ऐ नक्की ज छे के प्रत्येक कार्यमां निमित्त होय ज छे तो पछी तेनी शोध करवानी शुं आवश्यकता छे? प्रत्येक पदार्थज्यारे पर्यायगत योग्यताना कराणे विवक्षित पर्यायो धाराण करे छे, त्यारे तेने योग्य निमित्त पाण होय ज छे. ज्यारे भगवान महावीरनो छ्व सोणमां स्वर्गथी अवीने तीर्थकर इपे मनुष्यभव धाराण करी रवो हतो त्यारे मा ना इपमां निश्वास अने पिताना इपमां सिद्धार्थ सहजभावे उपस्थित ज छता.

शुं महावीरना छ्वे तेमनी शोध करी हती? कोई पाण व्यक्ति ज्यारे मनुष्यभव धाराण करे छे त्यारे मा-बाप विना तो धाराण करतो नथी; पाण शु तेने मा-बापनी शोध करवी पडे छे? शु आज सुधी कोई ऐ पाण एवुं कुर्म छे के बधुं सहजभावथी ज चाल्या करे छे?

जे प्रमाणे मा-बापनी शोध विना ज प्रत्येक मानवने जन्मकाले पोतानी योग्यतानुसार मा-बाप उपलब्ध रहे ज छे; ते ज प्रमाणे प्रत्येक

આત્માથિનિ આત્માનુભૂતિના કાળમાં વા તેના પૂર્વે સુયોગ્ય નિમિત્ત સહજ
ભાવથી ઉપલબ્ધ રહે જ છે, તેમને શોધવા મ્યાંય જવું પડતું નથી.

મહાવીરના જીવની સિંહની પથર્યમાં જ્યારે પાત્રતા પાકી ત્યારે
નિમિત્તરૂપે યુગલ મુનિરાજ સહજભાવથી ઉપસ્થિત જ હતા. તેમનો સંયોગ
મેળવવા સિંહે શું પ્રયત્ન કર્યો હતો? જીવનભર નિરંતર જ્ઞાનીઓના સંપર્કમાં
રહેનારા બધા લોકો શું સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી જ વે છે? આપણે બધાએ
એવા અનેક લોકોને જોયા છે કે ને જીવનભર જ્ઞાનીઓના સંપર્કમાં રહ્યા,
તેમની સેવા કરતા રહ્યા, પરંતુ કાંઈ પાગું હાથ ન લાગ્યું.

(૬) પ્રશ્ન : જે જ્ઞાનીઓના સત્ત્સમાગમમાં પાગ કોઈને કાંઈ ઉપલબ્ધ
ન થયું, તો એનો એ અર્થ તો નથી કે આપણે સત્ત્સંગતિ ન કરવી જોઈએ?

ઉત્તર : ના, એ અર્થ તો કદાચિ નથી. સત્ત્સમાગમમાં રહેવું એ તો
જીવનનું સૌભાગ્ય છે; કારાગ કે સત્ત્સંગની રચિ ન કેવળ આપણા ઉજાજવળ
ભવિષ્યની સૂચક છે, બલ્કે વર્તમાન નિર્મળ પરિણામોને પાગ બતાવે છે. જે
આપણા પરિણામ વર્તમાનમાં જ વિકૃત હોત તો આપણે અસ્ત લોકોના
સત્ત્સમાગમમાં જ રહેવાનું પસંદ કરત.

સત્ત્સમાગમ્ સારી બાબત હોવા છતાં પાગ સત્ત્સમાગમથી જ બધું
થઈ જવાવાળું નથી. સત્ત્સમાગમ તો નિમિત્તમાત્ર છે, જ્યાં સુધી આપણા
અંતરની તૈયારી નહીં થાય, ઉપાદાનગત યોગ્યતાનો પરિપાક નહીં થાય,
દાખિસ્ત સ્વભાવ-સંસ્કૃત નહીં થાય; ત્યાં સુધી આત્મકલ્યાણનો માર્ગ પ્રશરસ્ત
થવાનો નથી. આ વાતને પાગ સારી રીતે સમજી લેવી જોઈએ.

જીવનભર સત્ત્સમાગમમાં રહેવા છતાં પાગ આત્મલાભની પ્રાપ્તિ
ન થઈ - એનું એક માત્ર કારાગ પાગ એ જ છે કે તેમની દાખિસ્ત સત્ત્સમાગમ પર
જ રહી, સ્વભાવની સંસ્કૃત ન થઈ. તેથી સત્ત્સમાગમમાં રહેવું તો સારું છે,
પરંતુ તેના માટે વ્યચ્ચ થવાની જરૂર નથી. જેનું જેટલું મહત્વ છે તેટલું આપણે
અવશ્ય સ્વીકારવું જોઈએ; પરંતુ એ પાગ ધ્યાન રાખવું જોઈએ કે નેમ

સત્તુસમાગમના મહત્વનો અસ્વીકાર કરવામાં નુકસાન છે, તેનાથી વધારે નુકસાન તેને જરૂરિયાતથી વધારે મહત્વ આપવામાં છે.

વાસ્તવિક સત્ત તો પોતાનો ત્રિકાળી ધૂવ ભગવાન આત્મા જ છે. તેના સમાગમમાં જ સત્તનો લાભ થવાવાળો છે તેની સંગતિ જ વાસ્તવિક સત્તસંગતિ છે. આપણી શ્રદ્ધાનું શ્રદ્ધેય (દષ્ટિનો વિષય) જ્ઞાનનું જ્ઞેય અને ધ્યાનનું ધ્યેય તો ત્રિકાળી સત્ત નિજ ભગવાન આત્મા જ બનવો જોઈએ.

તે ત્રિકાળી ધૂવરૂપ સત્તનું સ્વરૂપ બતાવવાવાળા જ્ઞાની ધર્માત્મા જ સત્પુરૂપ કહેવાય છે. તેમની સંગતિને પણ સત્તસંગતિ કહે છે. બાકી પુણ્ય-પાપના પ્રપંચમાં ફસાયેલા લોકો ન તો સત્પુરૂપ છે કે ન તો તેમની સંગતિ પણ સત્તસંગતિ છે.

નિશ્ચય સત્તસંગતિ તો ત્રિકાળી ધૂવ ભગવાન આત્માના જ્ઞાન, શ્રદ્ધાન અને ધ્યાનનું જ નામ છે; પરંતુ આત્માનું સ્વરૂપ બતાવનારા આત્માનુભવની પ્રેરણા આપનારા, આત્માનુભવી મુડુષોની સંગતિને, તેમના દારા ત્રિકાળી ધૂવ ભગવાન આત્માનું સ્વરૂપ સાંભળવાને વ્યવહારથી સત્તસંગતિ કહે છે, માત્ર તેમની સેવા-સુશ્રૂપા કરતા રહેવું તેને તો વ્યવહારથી પણ સત્તસંગતિ ન કહી શકાય.

તેર્થી અમારું તો એ જ કહેવું છે કે નિશ્ચય સત્તસમાગમનાં ઉદેશથી વ્યવહાર સત્તસમાગમ કરવો પણ સારો જ છે.

(૧૦) પ્રેશન : શું ત્રિકાળી ધૂવ ભગવાન આત્માનું સ્વરૂપ બતાવનારા જ સજાજન છે, સત્પુરૂપ છે; બાકી બધા સજાજન નથી, સત્પુરૂપ નથી? લોકમાં તો એવા હજારો મહાપુરૂપ છે અને થઈ ગયા છે કે જે લોકોને દયા-દાનનો ઉપદેશ આપે છે, પરોપકારની પ્રેરણા આપે છે; ત્યાં સુધી કે જેમારે જગતના લોકોની સુખ-સુવિધા માટે પોતાનું સંપૂર્ણ જીવન જ સમર્પિત કરી દીધું છે. શું તેઓ સજાજન નથી, શું તેઓ સત્પુરૂપ નથી?

ઉત્તર : કેમ નહીં, તેઓ પાગ સજાજન છે; પાગ તે બધા લોકું સજાજન છે. જ્યારે અહીં તો લોકોત્તર માર્ગની વાત ચાલી રહી છે. લોકોત્તર માર્ગમાં તો તેમને જ સત્પુરુષ કહેવાય છે કે જેઓ મુક્તિના માર્ગ પર સ્વયં આડદ હોય અને જગતને પાગ મુક્તિનો માર્ગ બતાવતા હોય, જગતને મુક્તિના માર્ગ પર ચાલવાની પ્રેરણા દેતા હોય.

મુક્તિના માર્ગ પર ચાલવાની કિયા-પ્રક્રિયા સ્વાધીન કિયા છે, સ્વાધીન પ્રક્રિયા છે; તેથી તે ઉપાદાનના આશ્રયે જ સંપન્ન થાય છે, નિમિત્તના આશ્રયે નહીં. આત્મકલ્યાશનું મહાન કામ જે ઉપાદાનના આશ્રયે, જે ઉપાદાનને ધ્યાનનું ધ્યેય અને શ્રદ્ધાનનું શ્રદ્ધેય બનાવવાથી સંપન્ન થાય છે; તે ત્રિકાળી ઉપાદાન તો પ્રત્યેક વ્યક્તિનો પોતાનો ત્રિકાળી નિજ ભગવાન આત્મા જ છે. તેને જ ધ્યેય બનાવવાવાળી ધ્યાનપદ્ધતિ, તેને જ જીય બનાવવાવાળી જ્ઞાનપદ્ધતિ અને તેમાં જ પોતાપાણું સ્થાપિત કરવાવાળી શ્રદ્ધાનપદ્ધતિ લાગુંક ઉપાદાન છે.

તેથી ત્રિકાળી ઉપાદાનરૂપ નિજ ભગવાન આત્માનું સ્વરૂપ બતાવનારા જ્ઞાનીપુરુષ જ તે સત્પુરુષ છે; જેમનો ઉપદેશ મુક્તિના માર્ગમાં નિમિત્ત બને છે તથા એ જ કારણે તેઓ પાગ નિમિત કહેવાય છે. પરંતુ ધ્યાન રહે તેમનો પાગ એ જ ઉપદેશ વાસ્તવિક નિમિત છે કે જે ત્રિકાળી ધૂપ ભગવાન આત્માના સ્વરૂપને સ્પષ્ટ કરવા માટે અપાયો હોય, આત્માનો અનુભવ કરવાની પ્રેરણા માટે અપાયો હોય અને તેના કારણે જ તેમને મુક્તિના માર્ગમાં નિમિત્તરૂપે સ્વીકાર કરવામાં આવેલ છે.

જે લોકોને તે ત્રિકાળી ઉપાદાન ધૂપ પરમાત્માનો પરિચય જ નથી, જેની વાણીમાં તેની ચર્ચા પાગ નથી આવતી; બલ્કે જેઓ તેનું નામ સાંભળીને તેની ચર્ચા સાંભળીને ભરકી ઉઠે છે, ઉદ્દેલિત થઈ જાય છે, અશાંત થઈ જાય છે; તેની ચર્ચા કરનારાઓને ભલુ-ભૂં કહેવા લાગે છે; તેમના માટે તો હજુ દિલ્લી બહુ દૂર છે, તેઓ સ્વયં જ એ પરમતત્વથી અપરિચિત છે; તેથી તેઓ મુક્તિમાર્ગના સત્પુરુષ કેવી રીતે હોઈ શકે ?

જેઓને ત્રિકાળી સત્તનો પરિચય નથી, તેઓ સત્પુરૂપ નથી; તેમની સંગતિ પાણ સત્તસંગતિ નથી.

મુક્તિના અભિલાષી આત્માધીએ સત્તસંગતિ તો અવશ્ય કરવી જોઈએ પરંતુ સત્તસંગતિનું સાચું સ્વરૂપ સમજી સત્પુરૂપને ઓળખીને જ તેમના પ્રત્યે સમર્પિત થવું જોઈએ; અન્યથા બ્રહ્મિત થવાની સંભાવના પાણ ઓછી નથી.

સત્પુરૂપની સાચી ઓળખ જ એ છે કે જે ત્રિકાળી ધૂવરૂપ નિજ પરમાત્માનું સ્વરૂપ બતાવે અને તેની જ શરાગમાં જવાની પ્રેરાગા આપે તે જ સત્પુરૂપ છે. દુનિયાદીમાં ફસાવનારા, જગતના પ્રપંચમાં ફસાવનારા પુરૂષ ગમે તેવા સજ્જન કેમ ન હોય પાણ તે સત્પુરૂપ નથી-આ વાતને બરાબર સમજી લેવી જોઈએ.

એ વાતનું પાણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે આપાણે સત્તસંગતિના નામે અસત્તસંગતિમાં જ ન પડ્યા રહ્યો; નહિ તો આ મહા મૂલ્યવાન માનવજીવન એમ જ ચાલ્યું જશે, ભવનો અંત નહીં આવે. ભવનો અંત લાવવો હોય તો નિમિત્તાધીન દષ્ટિ છોડીને ત્રિકાળી ઉપાદાનરૂપ નિજ સ્વભાવનો આશ્રય લો અને તેનું સ્વરૂપ સમજાવનારા તેમાં જ જમી જવાની અને લીન થવાની પ્રેરાગા આપવાવાળા સત્પુરૂપની સંગતિ કરો, સમાગમ કરો, શરાગમાં જાઓ, આ જ એક માર્ગ છે, બાકી બધાં ઉન્માર્ગ છે.

(૧૧) પ્રેરણ : આપ તો કહો છો કે નિજ ભગવાન આત્માનું સ્વરૂપ બતાવનારા સત્પુરૂપ જ એકમાત્ર નિમિત્ત છે, પરંતુ અમે તો સાંભળ્યું છે કે કુંભાર પાણ નિમિત્ત હોય છે ?

ઉત્તર : તમે બરાબર જ સાંભળ્યું છે; કારાગ કે કુંભાર પાણ નિમિત્ત હોય જ છે, પાણ ક્યા કાર્યનું ? માટીનો ધડો બનવામાં કુંભાર નિમિત્ત હોય છે. ધડો એક કાર્ય છે અને તેનું ઉપાદાનકારાગ માટી છે અને નિમિત્તકારાગ કુંભાર-આ વાત તો શરૂઆતમાં જ સ્પષ્ટ કરવામાં આવી ચૂકી છે. પરંતુ અહીં તો સમ્યગ્દર્શનરૂપ કાર્યની વાત ચાલી રહી છે. મોક્ષ મહેલની પ્રથમ સીરીરૂપ જે સમ્યગ્દર્શનરૂપ કાર્ય છે, તેનું ઉપાદાન તો ભગવાન આત્મા

એક પ્રાણોત્તર

૩૫

અથવા તેનો શ્રદ્ધાગુણ જરૂર છે અને નિમિત્ત સત્પુરુષનો વિકાળી બુવ ભગવાન આત્માનું સ્વરૂપ બતાવનારો ઉપદેશ છે.

સમ્યગ્દર્શનની ઉત્પત્તિના કારાગુણના રૂપમાં જિનાગમમાં જે પાંચ લખિયાઓની ચર્ચા આવે છે; તેમાં એક દેશનાલખિય પાગ છે તે દેશનાલખિય આત્માના સ્વરૂપને સ્પષ્ટ કરવાવાળી સત્પુરુષની વાગીના રૂપમાં જ ઉપલબ્ધ થાય છે. તેને સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં બહિરંગ નિમિત્તના રૂપમાં સ્વીકારવામાં આવી છે; કારાગ કે અંતરંગ નિમિત્ત તો દર્શનમોહનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ હોય છે.

નિમિત્ત અને ઉપાદાન તો કારાગુણના પ્રકાર છે; તેથી તે તો પ્રત્યેક કાર્ય પર ઘટિત થાય છે. જિનાગમમાં આચાર્યોને ઘડા અને કુંભારના ઉદાહરણથી નિમિત્ત-નેમિત્તિક સંબંધને સમજવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તે તો એક ઉદાહરણ માત્ર છે, વાસ્તવમાં તો પ્રત્યેક કાર્યના પોત-પોતાના જુદા-જુદા ઉપાદાન-નિમિત્ત હોય છે. કાર્યોત્પત્તિની પ્રક્રિયા સમજવા માટે આ બંનેયને પ્રત્યેક કાર્ય પર ઘટિત કરીને જેવાં જોઈએ. પરંતુ અહીં અધ્યાત્મમનું પ્રકરાગ છે; તેથી સમ્યગ્દર્શનરૂપ કાર્ય પર ઉપાદાન-નિમિત્તને ઘટિત કરવામાં આવી રહ્યું છે. એ વિચાર કરવામાં આવી રહ્યો છે કે જે આપાગે સમ્યગ્દર્શનરૂપ કાર્યની ઉપલખ્ય કરવી હોય, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું હોય તો શું કરવું જોઈએ.

આ સંદર્ભમાં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે સમ્યગ્દર્શનરૂપ કાર્યનું કારાગ જે વિકાળી ઉપાદાનરૂપ બુવ નિજ ભંગવાન આત્મા છે, તેના આશ્રયથી જ મિથ્યાદર્શન પર્યાયનો અભાવ કરતી થકી સમ્યગ્દર્શન પર્યાય સ્વકાળમાં પ્રગટ થાય છે. જ્યારે સમ્યગ્દર્શનરૂપ પર્યાય પ્રગટ થાય છે, ત્યારે મિથ્યાત્વ નામના કર્મનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમરૂપ અભાવ નિયમથી થાય છે. તથા તેના પૂર્વે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાવાળા તે આત્માને કોઈ જ્ઞાની સત્પુરુષ પાયેથી ભગવાન આત્માનું સ્વરૂપ સ્પષ્ટ કરતા ઉપદેશનો લાભ પાગ અવશ્ય પ્રાપ્ત થાય છે.

આ રીતે સમ્યગ્દર્શનરૂપ કાર્યમાં મિથ્યાત્વ કર્મના ઉદ્યનો અભાવ અંતરંગ નિમિત્ત છે અને સત્પુરુષનો ઉપદેશ બહિરંગ નિમિત્ત છે.

(૧૨) પ્રશ્ન : જ્યારે સમ્યજ્ઞશર્ણના પૂર્વે દેશનાલભિય પાણ હોય જ છે અને તેમાં નિમિત્ત સત્પુરુષનો ઉપદેશ જ હોય છે તો પછી સત્પુરુષની શોધ તો કરવી જ પડે, સત્પુરુષની ઓળખાગું પાણ કરવી જ પડે; તો પછી આપ એવું કેમ કહો છો કે આત્માર્થિએ નિમિત્તોની શોધમાં વ્યાચ ન થવું જોઈએ?

ઉત્તર : હા, સત્પુરુષની ઓળખાગું તો કરવી જ જોઈએ. સાચી ઓળખાગું કર્યા વિના તો તગલે ને પગલે ઠગાઈ જવાની સંભાવના બની રહે છે. આ જ કારણે સાચા દેવ-શાશ્વત-ગુરુની શ્રદ્ધાને સમ્યજ્ઞશર્ણ કહેલ છે; કેમ કે સાચા દેવ-શાશ્વત-ગુરુની ઓળખ વિના તો સન્માર્ગ પર લાગવું જ સંભવ નથી.

આત્માર્થી ભાઈ-બહેન જ્ઞાની સત્પુરુષોની શોધ પાણ સહજભાવથી કરે જ છે. ન તો સત્પુરુષોની ઓળખ કરવાનો નિષેધ છે કે ન તેમની શોધ કરવાનો; પરંતુ શોધમાં વ્યાચ થવાનો નિષેધ તો છે જ. વ્યાચતાને તો કોઈપાણ રૂપે ઢીક ન માની શકાય.

ખરેખર વાત એમ છે કે ઉપાદાન અને નિમિત્તનો એક સુમેળ હોય છે. જ્યારે ઉપાદાનની તૈયારી હોય છે અર્થાત् પર્યાયિની પાત્રતા પાકે છે; ત્યારે સત્પુરુષનો સમાગમ પાણ સહજ જ પ્રાપ્ત થાય છે, સત્પુરુષની શોધ પાણ સહજપાણે સહજ થાય છે; કાંઈ પાણ અસહજ નથી થતું, બધું જ સહજપાણે જ થાય છે.

ત્રિકાળી સત્તની રૂચિમાં સત્પુરુષની શોધની પ્રક્રિયા સહજ જ સંપૂર્ણ થાય છે, વ્યાચતારી કાંઈ થતું નથી. આત્મહિતનો માર્ગ તો સહજનો ધ્યાન છે. સત્પુરુષની શોધ પાણ સહજ અને ત્રિકાળી ધ્રુવની અનુભૂતિ-પ્રતીતિ પાણ સહજ; બધું જ સહજ જ સહજ છે.

જ્યારે સંસાર-સાગરનો કિનારો નજીક આવી જાય છે, ત્યારે સહજપાણે જ આત્માની રૂચિ જાગૃત થાય છે. આત્મરૂચિ ભગવાન આત્મા અને આત્મજ્ઞ સત્પુરુષની શોધ તરફના પુરુષાર્થને પ્રેરિત કરે છે. સત્પુરુષના સમાગમથી આત્મરૂચિને અભૂતપૂર્વ બળ પ્રાપ્ત થાય છે; અધ્યયન, મનન,

એક પ્રશ્નોત્તર

૩૭

ચિંતનની પ્રક્રિયા પરથી વિમુખ થઈ સ્વોન્મુખ થઈ જય છે. રચિની તીવ્રતા અને પુરુષાર્થની પ્રબળતા દર્શિને સ્વભાવસન્મુખ તો કરે જ છે, જ્ઞાન અને ધ્યાન પર્યાયને પાણ આત્મોન્મુખ કરે છે અને આ નિમિત્ત-ઉપાદાનનો સહજ સુમેળ દેશનાલભિયી કરાગુલભિય તરફ ટેળતા સમ્યગ્દર્શન પર્યાય પ્રાપ્ત કરવાની સશક્ત ભૂમિકા તૈયાર કરી દે છે.

આ બધુંથ સહજ જ બને છે; તેથી જ કહેવાય છે કે આત્માથીએ નિમિત્તાની શોધમાં વચ્ચે ન થયું જોઈએ.

ક્ષયોપશમ અને વિશુદ્ધિલભિય ધારક પુરુષને સન્માર્ગની પ્રાપ્તિનો વિકલ્પ તો હોય જ છે, તે અર્થે શોધ-ખોળનું હોવું પાણ સ્વભાવિક જ છે. આ જ પ્રક્રિયામાં સતપુરુષની શોધ-ખોળ પાણ થાય છે, કાળલભિય અનુસાર ઉપલભિય પાણ થાય જ છે. સદગુરની ઉપલભિય અને તેમના ઉપદેશની પ્રાપ્તિ થવા ઉપરાંત પાણ જ્યાં સુધી કરાગુલભિયના પરિણામોની પાત્રતા ન પાડે; ત્યાં સુધી અધ્યાત્મ, મનન, ચિંતનની પ્રક્રિયા નિરંતર ચાલતી જ રહે છે. આ કાળ અંત: મુહૂર્ત પાણ હોઈ શકે છે અને તેથી વધુ પાણ હોઈ શકે છે; પરંતુ આ બધું જ તાણાવ વગર અત્યંત સહજભાવથી ચાલતું રહે છે અને સહજભાવથી જ ચાલતું રહેવું જોઈએ; કારાગ કે મુક્તિનો માર્ગ શાંતિનો માર્ગ છે, તણાવનો નહીં, વચ્ચતાનો નહીં.

(૧૩) પ્રશ્ન : જ્યારે કાર્યની ઉત્પત્તિમાં પાંચ સમવાયોનો સહજ સુમેળ હોય છે, નિમિત્ત-ઉપાદાનનો પાણ સહજ સુમેળ હોય છે; તો પછી એવું કેમ કહેવામાં આવે છે કે નિમિત્તાથીન દર્શિ છોડો, નિકાળી ઉપાદાનરૂપ નિજ-ભગવાન આત્માનો આશ્રય લો ?

ઉત્તર : નિમિત્ત 'પર' છે તેના પર દર્શિ રાખવાથી દર્શિ પરાધીન થાય છે. નિકાળી ઉપાદાનરૂપ નિજ ભગવાન આત્મા 'સ્વ' છે, તેના પર દર્શિ રાખવાથી દર્શિ સ્વાધીન બને છે. પરાધીનતા જ દુઃખ છે અને સ્વાધીનતા જ સુખ છે; તેથી સુખાથીનિ તો સ્વાધીનતા જ શૈયસ્કર છે.

વસ્તુત : વાત એમ છે કે જ્યારે કરાગુલભિય ઉપરાંત સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે; ત્યારે જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, ચારિત્ર આદિ સર્વ ગુણોની

પરિણતિ આત્મસન્મુખ થાય છે; તે સમયે નિકાળી નિજ ભગવાન આત્મા જ જ્ઞાનનું જ્ઞેય બને છે, શ્રદ્ધાનનું શ્રદ્ધેય બને છે; ધ્યાનનું ધ્યેય બને છે.

જે વી રીતે અનુભૂતિના કાળમાં સર્વ ગુણોની પરિણતિ આત્મસન્મુખ થાય છે, તેવી જ રીતે સર્વ ગુણોની પરિણતિમાં નિર્મળતા પાણું પ્રગટ થાય છે; આ જ કારણે કહેવાય છે કે “સર્વ ગુણાંશ સમકિત” તાત્પર્ય એ છે કે સમ્યગ્દર્શન આત્માના સંપૂર્ણ ગુણોના અંશોમાં સ્કુરાયમાન થાય છે. જ્ઞાન ગુણની પરિણતિ સમ્યગ્જ્ઞાનરૂપ થઈ જાય છે, શ્રદ્ધાગુણની પરિણતિ સમ્યગ્દર્શન રૂપ થઈ જાય છે; ચારિત્રગુણની પરિણતિ સમ્યક્યારિત્રરૂપ થઈ જાય છે. આનંદ (ચુખ) ગુણમાં પાણ અતીનિદ્રય આનંદ ઉમટી પડે છે. આખરે અનંત-ગુણોનો અંબંડપિંડ સંપૂર્ણ આત્મા જ સમ્યગ્દર્શિ થાય છે ને?

(૧૪) પ્રેષન : એ તો હીક, પાણ જે સત્પુરુષે આપાણને ચુખી થવાનો માર્ગ બતાવ્યો, સમ્યગ્દર્શન પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો; તેમની જ આવી ઉપેક્ષા તો બરાબર નથી, તેમને પાણ દાખિથી દૂર કરી દેવા તે, શું કૃતાંનતા નથી?

ઉત્તર : ના, એ કૃતાંનતા નથી, બલ્કે સાચી કૃતજ્ઞતા છે; કેમ કે તે સત્પુરુષ પાણ એમ જ દર્ઢે છે કે તમે દાખિને સંપૂર્ણ જગત પરથી હટાવીને સ્વભાવ સન્મુખ કરો. તેથી આ તો તેમની જ આજ્ઞાનું પાલન થયું. તમે જ કહો કે ગુરુજીની આજ્ઞાનું પાલન કરેનાર શિષ્ય કૃતાંની હોય છે કે કૃતજ્ઞ ?

ગુરુ દ્રોણાચાર્ય જ્યારે પોતાના શિષ્યોની પરીક્ષા લઈ રહ્યા હતા, ત્યારે વૃક્ષની ડાળી પર સ્થિત કૃત્રિમ પક્ષીની આંખને વીંઘવાનો આદેશ આપતાં તેમણે પોતાના બધા શિષ્યોને એ જ એક સવાલ કર્યો હતો કે તમને શું દેખાય છે અર્થાત્ તમારી દાખિમાં શું છે ?

જે લોકોએ એ ઉત્તર આપ્યો કે અમને બધું જ દેખાઈ રહ્યું છે - વૃક્ષ, ડાળી, પક્ષી, તેની આંખ અને ગુરુજી આપ પાણ. તે બધાને ગુરુજીએ વગર બાણ ચલાવ્યે જ નાપાસ કરી દીધા, જ્યારે અર્જુને કદ્યું કે માત્ર પક્ષીની આંખ, બીજું કાંઈ નહીં.

ત્યારે ગુરુજીએ ફરી પૂછ્યું - “હું પાગ નહીં ?”

“હા, આપ પાગ નહીં.” અનુભૂતિને આટલું કહ્યું કે તુરત ગુરુજીએ
કહ્યું - “ધોડો બાબુ.”

બાબુ શ્વિટ્યું અને જઈને પોતાના સાચા નિશાન પર લાગ્યું.

ગુરુજી તે જ અનુભૂતિની પ્રસન્ન થયા, જોગે દઢતાપૂર્વક કહી દીધું કે
આપ પાગ નથી દેખાતા. માત્ર કહ્યું જ નહિ, બલ્કે સાચે સાચ જ તોગે દષ્ટિના
વિપ્યમાંથી તે વખતે ગુરુજીને પાગ પૂથક કરી જ દીધા હતા. લક્ષ્યભેદનો આ
એક જ ઉપાય છે. અનુભૂતિનું કૃત્ય ગુરુની ઉપેક્ષા નહીં પાગ સર્વત્રેષ્ઠ સન્માન
હતું; કારણ કે તોગે સાચા અર્થમાં ગુરુજીની આજ્ઞાનું પાલન કર્યું હતું.

ન્યારે લૌકિક કાર્યની સિદ્ધિમાં પાગ, લક્ષ્યભેદમાં પાગ ગુરુને
દષ્ટિમાંથી હટાવવા અનિવાર્ય થઈ જાય છે તો પછી આત્મસિદ્ધિ જેવા
મહાનકાર્ય માટે ગુરુદેવને દષ્ટિના વિપ્યમાં કેવી રીતે રાખી શકાય ?

ગુરુદેવે બતાવેલા માર્ગ પર ચાલીને તે લક્ષની પ્રાપ્તિ કરવી કે જે
લક્ષની પ્રાપ્તિ માટે ગુરુદેવે નિર્દેશ કર્યો છે, માર્ગ બતાવ્યો છે; એ જ સદગુરુનું
સાચું સન્માન છે, આમાં તેમની ઉપેક્ષા તો રંઘમાત્ર પાગ નથી. કોઈ ગુરુ
નથી ઈચ્છિતા કે તેમનો શિષ્ય નિરંતર તેમના મોં સામે જ જોયા કરે કે તેમની
જ સ્તુતિ-પ્રશંસા કર્યા કરે અને જે ભગવાન આત્માનું સ્વરૂપ તેને
સમજાવવામાં આવ્યું છે, તેની આરાધનામાં તત્પર જ ન થાય.

સાચા શિષ્યના વદ્યમાં પાગ ગુરુનું સમુચ્ચિત સ્થાન અને સન્માન
તો સદા રહે જ છે અને વખતોવખત તે અભિવ્યક્ત પાગ થતું જ રહે છે;
પરંતુ અનુભવના કાળમાં તો તે જ્ઞાનનું જ્ઞેય પાગ નથી રહેતા - આ પાગ પરમ
સત્ય છે. આ વાતને પાગ આપાગે સારી રીતે સમજ લેવી જોઈએ.

લક્ષ્ય ભેદ માટે સન્નાદ થતાં પહેલા પાગ તે ગુરુનું સ્મરાગ કરી શકે
છે, કરે છે; લક્ષ્યભેદ કર્યા પછી પાગ કરી શકે છે, કરે છે; પરંતુ લક્ષ્યભેદના
કાળમાં કદી નહીં. આ જ પ્રમાણે આત્માનુભૂતિ માટે સન્નાદ પહેલા અને
આત્માનુભૂતિ થયા પછી શુભોપ્યોગમાં આવતાં ગુરુનું સ્મરાગ સંભવ છે,
પરંતુ આત્માનુભૂતિના કાળમાં તો કદી નહીં.

(૧૫) પ્રેષન : ગુરુનું સમરાગ આગળ-પાછળ જ કેમ, આત્માનુભૂતિના કાળમાં કેમ નહીં? આખરે નિમિત્તથી આવી ઉપેક્ષા શા માટે?

ઉત્તર : સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કાર્ય તો પોતાનામાં જ થવાનું છે, ઉપાદાનમાં જ થવાનું છે; શુરુમાં નહીં, નિમિત્તમાં નહીં; પોતાના આશ્રયે જ થવાનું છે, ગુરુના આશ્રયે નહીં. ગુરુ તો માર્ગદર્શક માત્ર છે, નિમિત્ત માત્ર છે. ન તેમનામાં કાંઈ થવાનું છે કે ન તેમનાથી કાંઈ થવાનું છે; જે કાંઈ થવાનું છે તે પોતાનામાં જ થવાનું છે અને પોતાનાથી જ થવાનું છે, પોતાના જ આશ્રયે થવાનું છે. તેમાંથી તો જે કાંઈ કહેવાનું હતું, સમજવવાનું હતું; તે કહી દીધું સમજવી દીધું અને તમે સમજ લીધું. હવે તમે તમારું કાર્ય કરો, ગુરજીને કેમ તમારી સાથે રાખવા દીઢ્યો છો, ઉપયોગમાં પાણ શા માટે રાખવા દીઢ્યો છો ?

ઝીણવટથી વિચાર કરીએ તો ક્ષયોપશમજ્ઞાન વાળાને એક સમયમાં એક જ વસ્તુ ઉપયોગમાં રહે છે. તેથી જ્યાં સુધી ગુરજી પાણ ઉપયોગમાં રહેશે, જ્ઞાનનું જ્ઞેય બની રહેશે; ત્યાં સુધી દાખિનો વિપય ભગવાન આત્મા જ્ઞાનનું જ્ઞેય નહીં બને, જ્યાં સુધી ત્રિકાળી ધૂવ નિજ ભગવાન આત્મા જ્ઞાનનું જ્ઞેય નહીં બને, ધ્યાનનું ધ્યેય નહીં બને, શ્રદ્ધાનનું શ્રદ્ધેય નહીં બને; ત્યાં સુધી આત્માનુભૂતિ નહીં થાય, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ નહીં થાય; સંવર નહીં થાય, ધર્મની શરૂઆત નહીં થાય.

ધર્મની શરૂઆત કરવાની વિધિ જ એ છે કે પહેલા ગુરપદેશપૂર્વક વિકલ્પાત્મક ક્ષયોપશમજ્ઞાનમાં નિજશુદ્ધાત્મતાવનું સ્વરૂપ સમજું, સમ્યક નિર્ણય કરી; ત્યાર બાદ ગુરુ આદિ સમસ્ત પરપદાર્થો પરથી ઉપયોગ હટાવીને ઉપયોગને આત્મસન્મુખ કરી અને આત્મામાં જ તન્મય થઈ જાય. આ આત્મતન્મયતા જ આત્માનુભૂતિનો ઉપાય છે, આત્માનુભૂતિ છે; આ જ ધર્મની શરૂઆત છે, આ જ સંવર છે. નિરંતર વૃદ્ધિગત આ આત્મસ્થિરતા જ નિર્જરા છે અને અનંતકાળ સુધી આત્મામાં જ સમાઈ જવું-લીન થઈ જવું એ જ વાસ્તવિક મોક્ષ છે, જે અનંતસુખસ્વરૂપ છે અને પ્રાપ્ત કરવા માટે એકમાત્ર પરમ-ઉપાદેય છે.

એક પ્રશ્નોત્તર

૪૯

(૧૬) પ્રશ્ન : અનુભૂતિના કાળમાં ભવે ન કરો, પરંતુ આગળ-પાછળ તો વારંવાર ગુરુના નામનો ઉલ્લેખ કરવો જ જોઈએ ને. પરંતુ આપના પર એ આરોપ લગાવવામાં આવે છે કે આપ બીજાઓની સરખામાગુણીએ ગુરુદેવશ્રીના નામનો ઉલ્લેખ ઓછો કરો છો. આ સંબંધમાં આપને શું કહેવું છે?

ઉત્તર : ઓછો કરીએ છીએ, પાગ કરીએ તો છીએ ને? ન કરતા હોઈએ એમ તો નથી ને. અરે ભાઈ! આ રાગ-દેખની વાતોથી શું લાભ છે?

અમારું તો એટલું જ કહેવું છે કે વાત-વાતમાં ગુરુના નામના ઉલ્લેખ ને જ ગુરુભક્તિ સમજવાવાળા અને વાત-વાતમાં ગુરુનું નામ ન લેવાવાળાને ગુરુદ્રોહી કહેવાવાળાએ એ વાત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ કે આચાર્ય કુંદ કુંદ અને આચાર્ય અમૃતચંદ્ર જેવા સમર્થ આચાર્યોએ પોતના ગુરુના નામનો ક્રાંત્ય પાગ ઉલ્લેખ સુન્દર કર્યો નથી. શું તેમના કોઈ ગુરુ જ નહિ રહ્યા હોય? શું તેમના કદ્યમાં પોતાના ગુરુ પ્રયે શ્રદ્ધા નહિ હોય? એમ તો સંભવ જ નથી. અરે ભાઈ! શ્રદ્ધા તો હદ્યની ચીજ છે, તે બીજાઓને બતાવવા માટે નથી હોતી. શ્રદ્ધાને વટાઈખાનારા લોકો આ તથયને સમજી શકતાં નથી.

અમે યથાસમય ન તો ગુરુદેવશ્રીનો નામોઉલ્લેખ કરવાનું કદી ચૂકીએ છીએ કે ન તો વાત-વાતમાં તેમને વચ્ચે લાવીને તેમના નામને વટાવવાનો પ્રયત્ન પાગ કરીએ છીએ.

(૧૭) પ્રશ્ન : પ્રાપ્ત કરવા માટે પરમ-ઉપાદેય અનંત સુખ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે નિમિત્ત-ઉપાદાનનું સ્વરૂપ સમજવાની શું જરૂર છે? તાત્પર્ય એ છે કે નિમિત્ત-ઉપાદાનનું સ્વરૂપ સમજવાથી વાસ્તવિક લાભ શું છે; કારાગ કે જ્યાં સુધી એનો વાસ્તવિક લાભ અને ઉપયોગિતા જ્યાલમાં નહીં આવે; ત્યાં સુધી તેને સમજવાની રંધી અગૃત નહીં થાય, ચિત્ત ઉલ્લસિત નહીં થાય.

ઉત્તર : એ વાત તો એકદમ સાચી છે કે જ્યાં સુધી કોઈ કાર્યની ઉપયોગિતા અને લાભ સ્પષ્ટ ન હેખાય; ત્યાં સુધી તે કાર્યમાં ઉત્સાહપૂર્વક

प्रवृत्ति थती नथी अने उत्साहपूर्वक प्रवृत्ति विना कार्यमां सहजता पाणि प्राप्त थती नथी.

तेथी निमित्त-उपादानने आगुवानी उपयोगिता अने तेने आगुवाथी थता लाभोथी परिचित थवुं अत्यंत आवश्यक छे.

प्रत्येक प्राणीना माथे सौथी बधु भोजे कर्तृत्वभुद्धिनो छे. कर्तृत्वना अहुंकारथी ग्रस्त आ प्राणी निरंतर कांઈक ने कांઈक करतो ज रहे छे, करतो रहेवानुं ज ईच्छे छे अने एम समजे छे के जे हुं आ बधुं करवानुं बंध करी दृष्टि तो न आगे शुं थई जर्शे? आगे बधुं ज अस्त-व्यस्त थई जर्शे.

आ कर्तृत्वना बोज तणे प्रत्येक प्राणी दबाई रख्यो छे अने निरंतर आकुण-व्याकुण थई रख्यो छे. ऐने ए विचारवानी कुरसद नथी के जे बोजथी हुं दबाई रख्यो हुं, ते बोज वास्तविक छे के कोरी कल्पनामात्र छे.

निमित्त-उपादाननुं रवृप समजवाथी ए वात अत्यंत स्पष्ट थई अय छे के प्रत्येक पदार्थ रवृयना परिणमननो ज कर्ता छे, अन्य पदार्थोना परिणमनमां तो ते मात्र निमित्त ज होय छे, कर्ता-धर्ता कांઈ पाणि नथी. आ रीते तेना माथेथी कर्तृत्वनो खूब मोटो भोजे सहज ज उतरी जय छे अने ते पोतानामां खूब हणवाशनो अनुभव करे छे.

ए ज प्रमाणे ज्यारे ते एम आणी ले छे के माझुं भलुं-भूऱु थवामां संपूर्ण उत्तरदायित्व माझुं ज छे; मारा परिणमनमां परपदार्थ तो निमित्त मात्र छे; तेमनो कांઈ पाणि हस्तक्षेप मारामां नथी, त्यारे आ आत्मानो अनंत भय तो समाप्त थई ज जय छे; बीजंओ प्रत्ये थवावाणो देखभाव पाणि ओछो थई जय छे, समाप्त जेवो ज थई जय छे; काराण के बीज पदार्थो प्रत्ये देख तो आ काराणे ज थतो हतो के आ समजतो हतो के आगे माझुं भूऱु कर्यु छे. ज्यारे तेणे आणी लीधुं के माझुं भूऱु थवामां आनु रंयमात्र पाणि योगदान नथी तो सहजभावथी ज तेना प्रत्ये देख समाप्त थई जय छे.

ए ज प्रमाणे ज्यारे एम आणी लेवामां आवे छे के कोई परपदार्थ माझुं भलुं पाणि करतो नथी के न करी शके छे तो पछी परपदार्थोनी साथे रागभाव पाणि थतो नथी. परपदार्थो प्रत्ये राग-देख थवा पाइल मूण काराण

એક પ્રશ્નોત્તર

૪૩

તો એ મૂઢભાવ-મિથ્યાત્વ હોય છે કે હું પરનું ભલું-બૂધું કરી શકું છું, કરું છું કે પરપદાર્થ મારું ભલું-બૂધું કરી શકે છે, કરે છે.

આ મૂઢભાવ જ અનંત આકુળતાનું કારણ છે. નિમિત્ત-ઉપાદાનનું સાચું સ્વરૂપ સમજવામાં આવતાં આ મૂઢભાવ મટી જય છે અને પછી તે મૂઢભાવથી થવાવાળી આકુળતા પાગું થતી નથી.

(૧૮) પ્રશ્ન : મૂઢભાવ અર્થાત્ મિથ્યાત્વ તો આત્માનુભૂતિ વગર મટતો નથી - એવું કહેવામાં આવે છે; પરંતુ અહીં આપ કહો છો કે નિમિત્ત-ઉપાદાનની સાચી સમજાગુણથી જ મૂઢભાવ મટી જય છે ?

ઉત્તર : નિમિત્ત-ઉપાદાનનું સ્વરૂપ સમજવાથી નિમિત્તાધીન દાખિ મટી જય છે. દાખિ નિમિત્તો પરથી હઠીને ત્રિકાળી ઉપાદાનરૂપ નિજસ્વભાવ તરફ ઢળે છે. નિજસ્વભાવ જ તો ભગવાન આત્મા છે અને ભગવાન આત્મા તરફ ઢળતી દાખિ જ આત્માનુભૂતિની પૂર્વવર્તી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાથી પાર થતી જ્ઞાનપર્યાય જ્યારે ત્રિકાળીનું નિજભગવાન આત્માને સીધી (પ્રત્યક્ષ) જૈય બનાવી લે છે, ત્યારે આત્માનુભૂતિ પ્રગટ થઈ જય છે અને તે જ સમયે મૂઢભાવ-મિથ્યાત્વ મટી જય છે.

તેથી એવું કહેવું અસંગત નથી કે નિમિત્ત-ઉપાદાનની સાચી સમજાગુણથી મૂઢભાવ-મિથ્યાત્વ મટી જય છે.

આમ, આધ્યાત્મિક સુખ-શાંતિનો મૂળ ઉપાય નિમિત્ત-ઉપાદાન સંબંધી સાચી સમજ જ છે. તેથી તેનું સ્વરૂપ સમજવામાં આપણસ ન કરવી જોઈએ, કઠાગ કહીને ઉપેક્ષા પાગું ન કરવી જોઈએ; બલ્કે પૂરી શક્તિ લગાવીને તેને સમજવાનો પ્રત્યન કરવો જોઈએ.

(૧૯) પ્રશ્ન : નિમિત્ત-ઉપાદાનને સમજવાથી આધ્યાત્મિક સુખ-શાંતિની જ પ્રાપ્તિ થાય છે કે લૌકિક દાખિએ પાગ કાંઈ લાભ છે? તાત્પર્ય એ છે કે જે આધ્યાત્મિક સુખ-શાંતિ જ પ્રાપ્ત થાય છે તો પછી આધ્યાત્મિક લોકો જ તેમાં ઉલ્લેખ; અમારા જેવા સામાન્ય માગસો એને સમજવામાં પોતાની શક્તિ શા માટે લગાવે, પોતાનો સમય શા માટે વેડફે?

ઉત્તર : અરે ભાઈ ! આધ્યાત્મિક સુખ-શાંતિ ઉપરાંત લૌકિક લાભ પાગ ધારું છે, લૌકિક શાંતિ પાગ પ્રાપ્ત થાય છે; પરંતુ લૌકિક લાભ બતાવતા

निमित्तोपादान

४४

पહेला हुं ए कहेवा माणु धुं के आध्यात्मिक सुख-शांति ज साची सुख-शांति छे; लौकिक सुख-शांति तो माथा परनो बोजे अभा पर मूँकवा समान छे. ते साची शांति छे ज नहीं.

‘आध्यात्मिक लोको ज तेमां उलझे, अमारा जेवा सामान्य माणसो अने समजवामां पोतानी शक्ति शा माटे लगावे, पोतानो समय शा माटे वेड़े’-अरे भाई ! ऐवी वातो केम करो छो ? आध्यात्मिक लोको कई जुदा नथी होता, तेमना जुदा गाम नथी वसता; जे लोको साचुं सुख ईच्छे छे, शांतिना ईच्छुक छे, पोताना आत्माने आगुवा-ओणभवा ईच्छे छे, ऐ दिशामां प्रयत्नशील छे, सक्षिय छे, सज्जन छे; ते बधा आध्यात्मिक ज छे.

‘अमे अने तमे साधारागु नथी, बधां आत्मार्थी छे, स्वयं भगवान छे. स्वभावथी तो बधां भगवान छे ज; पर्यायमां पाग अल्पकाणमां ज बे-चार भवोमां ज भगवान भनवावाणा छीअे-अेवुं केम नथी विचारता. हीन भावना राखीने - ‘अमे तो साधारागु माणस छीअे, लौकिक जन छीअे;’ - ए प्रकारनी वातो करीने निज भगवान आत्मानुं अपमान शा माटे करो छो ? त्राग लोकना नाथ आ महाप्रभु चैतन्यतत्वने दीन-हीन केम समजे छो ? तमे तो अनंतशक्तियोनो संग्रहालय छो, अनंतगुणोनी खाग छो, ज्ञान नो धनपिंड छो, आनंदनो रसकंद छो; ऐवी हीन वातो करवी ते तमने शोभतुं नथी. तमे पर्यायमां पोतापाणु छोडीने स्वभावमां पोतापाणु लावो; त्यारे ज तमारी आ दीनता मटशे.

आश्चर्यनी वात तो ए छे के निमित्त-उपादाननुं स्वरूप समजवामां लगावेला समय अने शक्तिने तमे समय अने शक्तिनी बरबाटी समजे छो. हुं तमने ज पूछवा माणु धुं के ते समय अने शक्तिने बचावीने तमे क्यां लगाववा ईच्छो छो ? अने अेवुं क्युं स्थान छे, ज्यां तमे तमारो समय अने शक्तिने लगावीने तेने सार्थक करी शक्शो ?

निमित्त अने उपादाननी साची समजागुमां लगावेलो उपयोग प्रकारान्तरे वीतराणी तत्त्वज्ञानमां ज लागेलो छे; आनाथी सारो उपयोग नो उपयोग भीजे कोई होइ शके नहि. हा, आत्मानुभूतिमां लागेलो उपयोग

એક પ્રચોત્તર

આનાથી પાગ મહાન છે; પરંતુ આ બધું પાગ એના માટે જ તો છે. તેથી નિમિત્ત-ઉપાદાનની સમજાગમાં લાગેલ સમય અને શક્તિ બરબાદ નથી થતી, બલ્કે સહખ્યગુણી થઈને ક્ષેળે છે. છે.

નિમિત્ત-ઉપાદાનની ચર્ચામાં ઉપયોગને લગાવવો તે ઉપયોગનું ઉલઝાવવું નહીં; સુલઝાવવું છે; આ ઉલઝવાનો નહીં, સુલઝવાનો માર્ગ છે.

‘અનુકૂળ સંયોગ જ લોકિક લાભ છે’ - એ દાખિથી વિચાર કરીએ તો પાગ એક વાત અત્યંત સ્પષ્ટ છે કે પ્રત્યેક પ્રાગુને અનુકૂળ સંયોગ પોતાની ઉપાદાનગત યોગ્યતા અને શુલકમોંના ઉદ્યના નિમિત્તથી પ્રાપ્ત થાય છે જે આ વાતને પાગ સારી રીતે સમજી લઈએ તો પછી આપાગે અનુકૂળ સંયોગો માટે, લોકિક સુખો માટે પાગ કોઈ બીજી વ્યક્તિના સામે હાથ નહીં ફેલાવીએ, દીન-હીન થઈને કોઈની ગુલામી નહીં સ્વીકારીએ; સદ્ભાવ અને સત્કર્મ કરવા માટે જ પ્રેરિત થઈશું.

આ સંદર્ભમાં સમયસાર બંધ-અધિકારની નીચેની ગાથાઓ (ગુજરાતી પદ્ધાનુવાદ) મનનીય છે-

જે માનતો-મુજથી હુઃખીસુખી શું કરું પર જીવને,
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે.

જ્ઞાન કર્મ-ઉદ્યે જીવ સર્વે દુખિત તેમ સુખી થતા,
તું કર્મ તો દેતો નથી, તેં કેમ દુખિત-સુખી કર્યો ?

જ્ઞાન કર્મ-ઉદ્યે જીવ સર્વે દુખિત તેમ સુખી બને,
તે કર્મ તુજ દેતા નથી, તો દુખિત કેમ કર્યો તને ?

જ્ઞાન કર્મ-ઉદ્યે જીવ સર્વે દુખિત તેમ સુખી બને
તે કર્મ તુજ દેતા નથી, તો સુખિત કેમ કર્યો તને

મરતો અને જે દુખી થતો-સો કર્મના ઉદ્યે બને,
તેથી ‘હણ્યો મેં, દુખી કર્યો’-તુજ મત શું નહિ મિથ્યા ખરે?

વળી નવ મરે, નવ હુઃખી બને, તે કર્મના ઉદ્યે ખરે,
મેં નવ હણ્યો, નવ દુખી કર્યો-તુજ મત શું નહિ મિથ્યા ખરે? ।

आ बुधि जे तुज - 'दुष्प्रित तेम सुझी कुं छुं ज्ञवने',

ते मूढ मति तारी अरे ! शुभ अशुभ बांधि कर्मने.

करुं छुं दुझी-सुझी ज्ञवने, वणी बध-मुक्त कुं अरे !

आ मूढ मति तुज छे निरर्थक, तेथी छे मिथ्या खरे.

सौ ज्ञव अध्यवसानकाराण कर्मथी बंधाय ज्यां

ने मोक्षमार्ग स्थित ज्ञवो मुकाय, तुं शुं करे भला ?'

उपरनी गाथाओमां ने कांઈ कहेवामां आव्युं छे, तेनाथी आ वात अत्यंत स्पष्ट थई ज्य छे के तमारुं परपदार्थोमां कांઈ पाग चालतुं नथी अने तमे बीजने सुझी-दुःखी करी शको छो के बांधी-छोटी शको छो अथवा बीज तमने सुझी-दुःखी करी शके छे के बांधी-छोटी शके छे-ऐ मान्यता एकदम जूठी छे, निरर्थक छे; काराण के प्रत्येक प्राणीना ज्ञवन-भराण अने सुख-दुख तेमनी पर्यायगत योग्यता अने तेमना कर्मोदयअनुसार ज थाय छे.

आवो निर्गुण थवाथी, परना कर्तृत्वनो अखंकार अने परथी भयनी भावना एकदम मटी ज्य छे. तेथी लौकिक शांति पाग प्राप्त थाय छे. परना कर्तृत्वना विकल्पोना शमनथी आध्यात्मिक कार्यो माटे समय पाग सखलभावथी उपलब्ध थवा लागे छे अने लौकिक ज्ञवन पाग सुख-शांतिमय थई ज्य छे.

(२०) प्रश्न : आमां तो ऐम कहेवामां आव्युं छे के पोताना पूर्व कर्मोदय अनुसार संयोग प्राप्त थाय छे. आमां विचारवानी वात ए छे के कर्म पाग निमित्त ज छे; तेथी निमित्तोथी कांઈ थतुं नथी - ऐ वात ज क्यां रही ?

उत्तर : अरे भाई ! संयोग तो पोतानी योग्यतानुसार ज होय छे, कर्म तो तेमां निमित्तमात्र छे. अहीं तो ऐम कहेवामां आवे छे के प्रत्येक प्राणीना संयोग-वियोगोमां, सुख-दुःखमां; उपादान तो ते स्वयं छे अने निमित्त तेना ज कर्मोदय छे; ऐमां तारे कांઈ नथी करवानुं. अहीं तो तेना निमित्त-उपादान बंने बतावीने तेना कर्तृत्वनी चिंताथी तने मुक्त करवामां आवे छे. तुं आना तरइ तो ध्यान आपतो नथी अने ते कथनमांथी निमित्तनुं ऐर काढे छे. ते कथन निमित्त पर ऐर आपवा माटे करवामां नथी आव्युं; परंतु ऐमां तो कर्तृत्वना बोजथी दबायेला आ प्राणीना बोजने घटाइवानो

પ્રયત્ન કરવામાં આવો છે.

કાર્યોત્પત્તિમાં નિમિત્ત-ઉપાદાનનું ટેટલું, શું અને કેવું સ્થાન છે-
એ વાત તો પહેલા ખૂબ સ્પષ્ટ કરી દીધી છે. અહીં પાણ તે પ્રમાણે જ
સમજવું અહીં તો એમ કહેવામાં આવે છે કે તું નિશ્ચિંત રહે, તારે પરમાં કાંઈ
કરવાનું નથી; તેના નિમિત્ત-ઉપાદાન તારાથી જુદાં છે અને તે પોત-પોતાનું
કામ ખૂબ સારી રીતે નિભાવી રહ્યાં છે, તારે ત્યાં ઉલ્લંઘાની જરૂરત નથી.
અરે ભાઈ, નિમિત્ત અને ઉપાદાનનું સાચું સ્વરૂપ સમજવામાં લૌકિક
અને પારલૌકિક લાભ જ લાભ છે; તેથી તેમના સ્વરૂપને સમજવામાં
ઉપયોગને લગાવ. તને નિશ્ચિંત જ લૌકિક અને પારલૌકિક સુખ-શાંતિની
પ્રાપ્તિ થશે. વધુ સંકલ્પ-વિકલ્પોમાં ઉલ્લંઘાની કોઈ લાભ નથી.

નિમિત્ત-ઉપાદાનના સ્વરૂપને સ્પષ્ટ કરવા અને તેના સંબંધમાં
ઉલ્લંઘાની શંકા-આશંકાઓના નિરાકરણમાં જોટલો પાણ સંભવ હતો તેટલો
પ્રયત્ન કરવામાં આવો છે; હવે આથી વધારે વિસ્તારથી કાંઈ પાણ પ્રયોગન નથી.

તેથી એ પવિત્ર ભાવના સાથે વિરામ લઇન્દું કે સર્વ આત્માથી જન
નિમિત્ત-ઉપાદાનનું સાચું સ્વરૂપ સમજીને લૌકિક અને પારલૌકિક સુખ
શાંતિ પ્રાપ્ત કરે.

પર તો નિમિત્તમાત્ર છે.

જ્યાં સુધી પરપદાર્થોમાં ફેરફાર કરવાની બુદ્ધિપૂર્વક પરોન્મુખી
પ્રવૃત્તિઓ રહેશે, ત્યાં સુધી સત્યને પ્રાપ્ત કરવું તો બહુ દૂર, તેના નજીક પહોંચવું
પાણ સંભવ નથી.

શુદ્ધાત્મતસ્વરૂપી સત્યની સાથે એ પાણ એક તથ્ય છે કે પ્રત્યેક દ્રવ્ય
સ્વયં પરિશુદ્ધમનશીલ છે, તેને પોતાના પરિશુદ્ધમનમાં પરના સહયોગની રંધમાત્ર
પાણ આવશ્યકતા નથી. તો પાણ અજ્ઞાની આત્મા વર્થ જ પરના સહયોગની
આકાંક્ષાથી વાકુળ થાય છે. સત્યની પ્રાપ્તિ પોતાનાથી, પોતાનામાં, પોતાના
દીરા જ થાય છે; એમાં પરનું કાંઈ પાણ ચાલતું નથી. પર તો નિમિત્તમાત્ર છે.

-સત્યની શોધ.

३४ उपादान निमित्त

- ६ उपादान से ज्ञान हु एवं उपादान-निमित्त का विवरण
जो विवर है यह ज्ञान । ७ विवर जिसका ज्ञान है वह ज्ञान
जो विवर है जो ज्ञान की विवरण विवरण विवरण विवरण
परिशिष्ट - १

उपादान निमित्त दोहा

- कविवर पटित बनारसीदास

गुरु उपदेश निमित्त बिन उपादान बलहीन ।
ज्यों नर दूने पांव बिन चबवे को आधीन ॥ १ ॥

हो जने था एक ही उपादान सों काल ।
थके सहाइ पौन बिन पानी मांहि जहाल ॥ २ ॥

ज्ञान नेन किरिया चराण दोउ शिवमग धार ।
उपादान निश्चय जहाँ तहाँ निमित्त व्यवहार ॥ ३ ॥

उपादान निजगुण जहाँ तहाँ निमित्त पर होय ।
लेदज्ञान परमाण विधि विरला बुझे कोय ॥ ४ ॥

उपादान बल जहाँ तहाँ नहिं निमित्त को दाव ।
एक चक्र सों रथ चबे रवि को धडे स्वभाव ॥ ५ ॥

सधि वस्तु असहाय जहाँ तहाँ निमित्त हे कोन ।
ज्यों जहाल परवाह में तिरै सहज बिन पौन ॥ ६ ॥

उपादान विधि निरवचन हे निमित्त उपदेश ।
वसे जु ज्ञेसे देश में धरे सु तैसे लेख ॥ ७ ॥

ਪਰਿਸ਼ਾਇ - ੨

ਉਪਾਦਾਨ - ਨਿਮਿਤ ਦੋਹਾ

- ਮੈਥਾ ਭਗਵਤੀਦਾਸ

ਪਾਏ ਪ੍ਰਾਣ ਮਿ ਜਿਨਦੇਹ ਕੇ, ਏਕ ਉਕਿਤ ਉਪਯ ।

ਉਪਾਦਾਨ ਅਲੁ ਨਿਮਿਤ ਕੋ, ਕਹੁੰ ਸੰਵਾਦ ਬਨਾਯ ॥ ੧ ॥

ਪ੍ਰਥਿਤ ਹੈ ਕੋਉ ਤਛੌ, ਉਪਾਦਾਨ ਕਿਲ ਨਾਮ ।

ਕਹੋ ਨਿਮਿਤ ਕਹਿਯੇ ਕਹਾ, ਕਬ ਕੇ ਹੋ ਈਹ ਠਾਮ ॥ ੨ ॥

ਉਪਾਦਾਨ ਨਿਜ ਸ਼ਕਿਤ ਹੈ, ਨਿਧ ਕੋ ਮੂਲ ਸ਼ਬਦਾਵ ।

ਹੈ ਨਿਮਿਤ ਪਰਥੋਗ ਤੋਂ, ਬਨ੍ਯੋ ਅਨਾਦਿ ਬਨਾਵ ॥ ੩ ॥

ਨਿਮਿਤ ਕਹੇ ਮੋਕੋਂ ਸਾਡੇ, ਜਨਤ ਹੈ ਜਗਲੋਧ ।

ਤੇਰੋ ਨਾਵ ਨ ਜਾਣਹੀ ਉਪਾਦਾਨ ਕੋ ਹੋਧ ॥ ੪ ॥

ਉਪਾਦਾਨ ਕਹੇ ਰੇ ! ਨਿਮਿਤ, ਤੂ ਕਹਾ ਕਰੈ ਗੁਮਾਨ ।

ਮੋਕੋਂ ਜਨੇਂ ਜਾਵ ਵੇ, ਜੇ ਹੋਂ ਸਮਝਵਾਨ ॥ ੫ ॥

ਕਹੇਂ ਜਾਵ ਸਥ ਜਗਤ ਕੇ, ਜੇ ਨਿਮਿਤ ਸੋਈ ਹੋਧ ।

ਉਪਾਦਾਨ ਕੀ ਬਾਤ ਕੋ, ਪ੍ਰਥੇ ਨਾਲੀਂ ਕੋਧ ॥ ੬ ॥

ਉਪਾਦਾਨ ਬਿਨ ਨਿਮਿਤ ਤੂ, ਕਰ ਨ ਸਕੇ ਈਕ ਕਾਲ ।

ਕਹਾ ਭਧੋ ਜਗ ਨਾ ਲਖੈ, ਜਨਤ ਹੋ ਜਿਨਰਾਵ ॥ ੭ ॥

ਈ-ਜਿਨੇਥਰ ਗੁਰੂ-ਧਰੀ, ਅਲੁ ਜਿਨ-ਆਗਮਸਾਰ ।

ਈ ਨਿਮਿਤ ਤੋਂ ਜਾਵ ਸਥ, ਪਾਵਤ ਹੋਂ ਭਵ-ਪਾਰ ॥ ੮ ॥

ਧਹ ਨਿਮਿਤ ਈਹ ਜਾਵ ਕੇ, ਮਿਲਧੀ ਅਨਨਤੀਬਾਰ ।

ਉਪਾਦਾਨ ਪਲਟਧੀ ਨਾਲੀ, ਤੋ ਭਟਕਧੀ ਸੰਸਾਰ ॥ ੯ ॥

ਤੇ ਕੇਵਲਿ ਤੇ ਸਾਧੁ ਕੇ ਨਿਕਟ ਭਵਧ ਜੇ ਹੋਧ ।

ਸੋ ਕਾਧਿਕ ਸਮਝ ਲਹੇ, ਧਹ ਨਿਮਿਤ ਬਲ ਜੇਧ ॥ ੧੦ ॥

ਕੇਵਲਿ ਅਰੂ ਮੁਨਿਰਾਜ ਕੇ, ਪਾਸ ਰਹੋਂ ਬਲ੍ਲੁ ਲੋਧ ।
ਪੈ ਜਕੀ ਸੁਲਦ੍ਯੀ ਧਨੀ, ਕਾਇਕ ਤਾਕੋਂ ਹੋਧ ॥ ੧੧ ॥

ਛਿੰਸਾਇਕ ਪਾਪਨ ਕਿਧੇ, ਜ਼ਿਵ ਨਰਕ ਮੇਂ ਜਾਇਂ ।
ਜੇ ਨਿਮਿਤ ਨਹੀਂ ਕਾਮ ਕੋ, ਤੋ ਈਮ ਕਾਹੇ ਕਲਾਇਂ ॥ ੧੨ ॥

ਛਿੰਸਾ ਮੇਂ ਉਪਯੋਗ ਜ਼ਹਾਂ, ਰਹੇ ਭਰਤ ਕਾ ਰਾਚ ।
ਤੇਈ ਨਰਕ ਮੇਂ ਜਾਤ ਹੇ, ਮੁਨਿ ਨਹਿਂ ਜਾਇਂ ਕਦਾਚ ॥ ੧੩ ॥

ਦਧਾ-ਦਾਨ-ਪੂਜਾ ਕਿਧੇ; ਜ਼ਿਵ ਸੁਖੀ ਜਗ ਹੋਧ ।
ਜੇ ਨਿਮਿਤ ਜੂਠੀ ਕਹੀ, ਧਹ ਕ੍ਰਿਆਂ ਮਾਨੇ ਲੋਧ ॥ ੧੪ ॥

ਦਧਾ-ਦਾਨ-ਪੂਜਾ ਭਲੀ, ਜਗਤ ਮਾਇ ਸੁਖਕਾਰ ।
ਜ਼ਹੁੰ ਅਨੁਭਵ ਕੋ ਆਚਰਣ, ਤਹੁੰ ਧਹ ਬਨ੍ਧ ਵਿਚਾਰ ॥ ੧੫ ॥

ਧਹ ਤੋ ਬਾਤ ਪ੍ਰਸਿੱਖ ਹੇ, ਸੋਚ ਵੇਖ ਉਰ ਮਾਇਂ ।
ਨਰਦੇਹੀ ਕੇ ਨਿਮਿਤ ਬਿਨ, ਜਿਥ ਪ੍ਰਮੋਂ ਮੁਝਿਨ ਨ ਜਾਇਂ ॥ ੧੬ ॥

ਦੇਹ ਪੀਂਵਰਾ ਜ਼ਿਵ ਕੋ, ਰੋਕੇ ਸ਼ਿਵਪੁਰ ਜਾਤ ।
ਉਪਾਦਾਨ ਕੀ ਥਾਂਝਿ ਸੌ, ਮੁਝਿਨ ਹੋਤ ਰੇ ਭਾਤ ॥ ੧੭ ॥

ਉਪਾਦਾਨ ਸਬ ਜ਼ਿਵ ਪੈ, ਰੋਕਨ ਹਾਰੋ ਕੌਨ ।
ਜਾਤੇ ਕ੍ਰਿਆਂ ਨਹਿਂ ਮੁਝਿਨ ਮੇਂ, ਬਿਨ ਨਿਮਿਤ ਕੇ ਹੌਨ ॥ ੧੮ ॥

ਉਪਾਦਾਨ ਸੁ ਅਨਾਇ ਕੋ, ਉਲਟ ਰਖ੍ਯੋ ਜਗ ਮਾਇਂ ।
ਸੁਲਭਤ ਹੀ ਸੂਧੀ ਚਲੇ, ਸਿੱਖ ਲੋਕ-ਕੋ ਜਾਇਂ ॥ ੧੯ ॥

ਕਹੀ ਅਨਾਇ ਨਿਮਿਤ ਬਿਨ, ਉਲਟ ਰਖ੍ਯੋ ਉਪਯੋਗ ।
ਏਸੀ ਬਾਤ ਨ ਸੰਭਵੇ, ਉਪਾਦਾਨ ਤੁਮ ਜੋਗ ॥ ੨੦ ॥

ਉਪਾਦਾਨ ਕਹੇ ਰੇ ਨਿਮਿਤ, ਹਮ ਪੈ ਕਹੀ ਨ ਜਾਧ ।
ਏਸੇ ਹੀ ਨਿਨ ਕੇਵਲੀ, ਦੇਖੇ ਨਿਭੁਵਨ ਰਾਧ ॥ ੨੧ ॥

ਜੇ ਦੇਖ੍ਯੋ ਭਗਵਾਨ ਨੇ, ਸੋ ਹੀ ਸਾਂਚੀ ਆਇਂ ।
ਹਮ-ਤੁਮ ਸੰਗ ਅਨਾਇ ਕੇ, ਭਲੀ ਕਹੀਗੇ ਕਾਇਂ ॥ ੨੨ ॥

ਉਪਾਦਾਨ ਕਹੇ ਵਹ ਭਲੀ, ਜਕੋ ਨਾਥ ਨ ਹੋਧ ।
ਜੇ ਉਪਜਨਤ ਵਿਨਥਤ ਰਹੇ, ਭਲੀ ਕਹਾਂ ਤੋਂ ਸੋਧ ॥ ੨੩ ॥

उपादान तुम जेर हो, तो क्यों लेत अहार ? ।

पर निमित्त के योग सों, शृङत सब संसार ॥ २४ ॥

जे अहार के जेग सों, शृङत हे जगमाहिं ।

तो पासी संसार के, कोउ मरते नाहिं ॥ २५ ॥

सूर सोम मणि अजिन के, निमित्त लधें ये नेन ।

अन्धकार में कित गयो, उपादान दृग देन ॥ २६ ॥

सूर सोम मणि अजिन जे, करे अनेक प्रकाश ।

नेन शक्ति बिन ना लधें, अन्धकार सम भास ॥ २७ ॥

कहे निमित्त वे शृङ को मो बिन जग के मांहि ।

सबे हमारे वश परे, हम बिन मुक्ति न जाहिं ॥ २८ ॥

उपादान कहे रे निमित्त ! ऐसे बोल न बोल ।

तोको तज निज भजत हें, ते ही करें क्लोल ॥ २९ ॥

कहे निमित्त हम को तजे, ते कैसे शिव जात ।

पंच महाप्रत प्रगट हे, औरहु किया विष्णात ॥ ३० ॥

पंच महाप्रत जेग त्रय, और सकल व्यवहार ।

पर को नमित जिपाय के, तब पहुँचे भव-पार ॥ ३१ ॥

कहे निमित्त जग में बड़यो, मो तें बड़ो न कोय ।

तीन लोक के नाथ सब, मो प्रसाद तें होय ॥ ३२ ॥

उपादान कहे तू कहा, चहुँ गति में ले जाय ।

तो प्रसाद तें शृङ सब, हुःभी होहि रे भाय ॥ ३३ ॥

कहे निमित्त जे हुःभ सहे, सो तुम हमहिं लगाय ।

सुखी कौन तें होत हें, ताको देहु भताय ॥ ३४ ॥

जे सुख को तू सुख कहे, सो सुख तो सुख नाहिं ।

ये सुख तो हुःभ - मूल हें, सुख अविनाशी मांहि ॥ ३५ ॥

डॉ. हुकमचन्द भारिल्ल के महत्वपूर्ण प्रकाशन

१.	पण्डित टोडरमल : व्यक्तित्व और कर्तृत्व	२०.००
२.	समयसार अनुशीलन भाग-१ (१ से ६८ गाथा तक)	२०.००
३.	समयसार अनुशीलन भाग-२ (६९ से १६३ गाथा तक)	२०.००
४.	समयसार अनुशीलन भाग-३ (१६४ से २३६ गाथा तक)	१०.००
५.	समयसार अनुशीलन भाग-४ (पूर्वार्द्ध) (गाथा २५७ से ३०७ तक)	१६.००
६.	परमभावप्रकाशक नवचक्र (हिन्दी, गुजराती)	१५.००
७.	आत्मा ही है शरण	२०.००
८.	चिन्तन की गहराइयाँ	१२.००
९.	बिखरे मोती	१२.००
१०.	तीर्थकर भगवान महावीर और उनका सर्वोदय तीर्थ (हिन्दी, गुजराती, मराठी, तमिल, कन्नड़, अंग्रेजी)	१२.००
११.	सत्त की खोज (हिन्दी, गुजराती, मराठी, तमिल, कन्नड़)	१०.००
१२.	धर्म के दशलक्षण (हिन्दी, गुजराती, मराठी, कन्नड़, तमिल, अंग्रेजी)	८.००
१३.	बाहु भावना : एक अनुशीलन	८.००
१४.	क्रमबद्धपर्याय (हिन्दी, गुजराती, मराठी, कन्नड़, तमिल, अंग्रेजी)	७.००
१५.	गागर में सागर	८.००
१६.	बीतराग-विज्ञान प्रशिक्षण निर्देशिका	५.००
१७.	आचार्य कुन्दकुन्द और उनके पंच परमाम	६.००
१८.	आप कुछ भी कहो (हिन्दी, गुजराती, मराठी, कन्नड़, अंग्रेजी)	६.००
१९.	पंचकल्याणक प्रतिष्ठा महोत्सव	३.५०
२०.	निमित्तोपादान (हिन्दी, गुजराती, मराठी, कन्नड़)	५.००
२१.	युगपुरुष कानजीस्वामी (हिन्दी, गुजराती, मराठी, तमिल, कन्नड़)	२.५०
२२.	अहिंसा : महावीर की दृष्टि में (हिन्दी, मराठी, गुजराती, अंग्रेजी)	१.५०
२३.	शाश्वत तीर्थधाम : सम्मदेशिखर	२.००
२४.	चैतन्य चमत्कार मैं कौन हूँ (हिन्दी, गुजराती, मराठी, कन्नड़, तमिल, अंग्रेजी)	४.००
२५.	कुन्दकुन्द शतक (हिन्दी, गुजराती, कन्नड़, अंग्रेजी)	१.००
२६.	शुद्धात्म शतक (हिन्दी, कन्नड़)	१.००
२७.	सार समयसार	१.००
२८.	तीर्थकर भगवान महावीर (हि., गु., म., क., त., अं., ते.)	१.००
२९.	बीतरागी व्यक्तित्व : भगवान महावीर (हिन्दी, गुजराती)	१.००
३०.	अनेकान्त और स्याद्वाद	२.००
३१.	समयसार पद्यानुवाद	१.००
३२.	समयसार कलश पद्यानुवाद	१.००
३३.	गोमटेश्वर बाहुबली : एक नया चिन्तन	१.००
३४.	शाकाहार : जैनदर्शन के परिप्रेक्ष्य में	१.५०
३५.	गोली का जवाब गोली से भी नहीं	१.००
३६.	अर्चना (जेवी साइज)	१.००
३७.	बाहु भावना एवं जिनेन्द्र बन्दना (जेवी साइज)	३.००
३८.	बालबोध पाठमाला भाग-२ (हि., गु., म., क., त., बं., अं.)	३.००
३९.	बालबोध पाठमाला भाग-३ (हि., गु., म., क., त., बं., अं.)	३.००
४०.	बालबोध पाठमाला भाग-४ (हि., गु., म., क., अं.)	३.००
४१.	बीतराग-विज्ञान पाठमाला भाग-१ (हि., गु., म., क., अं.)	४.००
४२.	बीतराग-विज्ञान पाठमाला भाग-२ (हि., गु., म., क., अं.)	३.००
४३.	बीतराग-विज्ञान पाठमाला भाग-३ (हि., गु., म., क., अं.)	४.००
४४.	तत्त्वज्ञान पाठमाला भाग-१ (हि., गु., म., क., अं.)	४.००
४५.	तत्त्वज्ञान पाठमाला भाग-२ (हि., गु., म., क., अं.)	४.००